



બાપુની છબી

કાકા કલેલકર

બાપુની છબી

કાકા કાલેલકર

સંપાદક
મહેન્દ્ર મેઘાણી



લોકમિલાપ ટ્રસ્ટ

આવુત્તિ 1 : 1998, જાન્યુઆરી 30 : 50મી ગાંધી-પુષ્ટિથિ

રૂ. 10

10 નકલના રૂ. 80 : 100 નકલના રૂ. 700
[10 કે વધુ નકલના રવાનગી-ખરચ સાથે]

પૂછા પરની છબી.

ગાંધીજી : 1946

[સુમત્તિ મોરારજીના સૌજન્યથી]

દક્ષાશક : ગોપાલ મેઘાણી

લોકમિલાપ ટ્રસ્ટ, પો. બો. 23 (સરદારનગર), ભાવનગર 364001

ફોન : (0278) 566402

મુદ્રક : અપૂર્વ આશાર

અમેજ સિસ્ટમ્સ, 301, વૈભવી કોમ્પ્લેક્સ, ફિલેહપુર પોલીસચોકી પાછળ,

પાલદી, અમદાવાદ 380007. ફોન : 661 0441

અરૂપણ

દ્રક્ષિણ આછિકાના અરણ્યમાંની
ગાંધીજીની ઘોર તપસ્યાની અવિસ્મરણીય છબી
“જીવનનું પરોઢામાં આદેખનાર
ભભુદાસ ગાંધીની પુણ્યસ્મૃતિને

કુરમ

સંપાદકનું નિવેદન	[6]
જીવનરસથી ભર્યું ભર્યું (અમાશંકર જોશી)	[8]
આધુનિક ભારતની સાધના (અમાશંકર જોશી)	[11]
દોહન કરનાર નીકળશે (કાકા કાલેલકર)	[12]
ગાંધીજીને “લોન”	1
યુદ્ધથીયે વધારે હિંસા	3
બહારવટિયા પાસેથી મળેલી સૂર્જ	4
સામા માણસ પર વિશ્વાસ	5
ગાંધીજીનું ઘડતર	6
“કોને મદદ કરીએ ?”	7
જનતા પરની શરદ્ધા	8
પાપીનો પણ પ્રતિનિધિ	10
“આવું ઘણું સાચવવું પડે છે...”	11
સનાતની છતાં સુધારક	12
સત્રશિશ્ય મેળવવાનું સદ્ગ્રાહ્ય	13
કુશળ માળી	14
ગાંધીજીનો એકમાત્ર શિશ્ય	15
અદ્ભુત રસાયણ	16
“ભૂલે એવો નથી !”	17
મારીના માણસોમાંથી	18
અડધો કલાક આપવા તૈયાર	19
સારો જેલાડી	20
પોતાનાંને હોમનારા	21
ગાંધીજીનું સ્ત્રી-હૃદય	22

બહેનોના બાપુ	23
સરકાર જ અન્યાય કરે ત્યારે	25
જીવનના કલાકાર	26
જીવન-કલાનું પ્રથમ લક્ષણ	27
એક પુસ્તક માટે અપવાદ	29
પુસ્તક-ભંડાર	29
“ત્યાગ કર્યો હોય તો—”	30
અવતારી પુરુશ નહીં	30
તારાઓનો સ્વાદ	31
“આ દુર્દશા દૂર કરો !”	34
ધર્મયુદ્ધના નિયમો	35
પેટ ભરાયું નહીં	36
લોકોનાં હૈયાંમાં પેસવા	37
કલમ દ્વારા કામ	38
સ્વરાજ્ય સરકારનો પણ આધાર નહીં	39
હૃદયની વિશાળતા	41
ફૂક્ત એક બાબતમાં—	42
વિરોધકુતિ છીનવી લેનાર	42
નમ્રતાનો અવતાર	43
ચારિત્ર્ય-નિરમાણની પ્રયોગશાળા	44
દર દસ માસીલે આશ્રમ	45
એકલો	46
શરદ્ધાનું પ્રતિબિંબ	47
આજના કાળમાં ગાંધી	48
સુતિ નહીં, અનુકરણ	49

સંપાદકનું નિવેદન

આ ચોપડીનું શરેય એક રીતે શરી રવીન્દ્ર કેળેકરના ‘કાકા કાલેલકર સાથે વિવિધ વારૂતાલાપો’ને જાય છે. એક પચ્ચીસી પહેલાં બધાર પડેલા એ પુસ્તકમાં, શરી અનુમાંશંકર જોશી તેના પ્રવેશકમાં કહે છે તેમ, “આધુનિક ભારતના અનિતિહાસના તારતાર સાથે આત્મિયતાથી જોડાયેલી કાકાસાહેબ જેવી વયોવૃદ્ધ સાંસ્કૃતિક વ્યક્તિત્વનું ચિંતન સુરેખ રીતે” રજૂ થયેલું છે.

હવે અપ્રાય બનેલું એ સુંદર પુસ્તક ગયે વરસે નવેસર વાંચતાં એવું લાગ્યું કે તે આખું અત્યારે ફરીથી છાપી શકાય તેમ ન હોય, તો છેવટે તેનો સંફરોપ પણ વાચકોને મળવો જોઈએ. એવી હોંશથી મેં તેને લગભગ પાંચમાં ભાગ જેટલું ટૂંકાવી નાખ્યું, પણ પછી વળી લોભ લાગ્યો કે સાથે સાથે કાકાસાહેબનાં બીજાં પુસ્તકોમાંથી પણ ચિંતનાત્મક અંશોનું સંકલન કરીને તેની સાથે જોડી શકાય તો સારું થાય. એટલે કાકાસાહેબનાં સમગ્ર લખાણોને સમાવતી ‘કાલેલકર રંથાવલિ’ના પંદર ભાગમાંથી કેટલાક અથલાવવા માંડ્યા. એ સેંકડો પાનાં વાંચતાં વાચતાં સમજાયું કે એવા સંકલનનું તો મોઢું પુસ્તક થાયી જાય એટલી સામગ્રી એ રંથાવલિમાં પડેલી છે.

મારે તો તૈયાર કરવી હતી કીમત અને કદની દ્રવ્યશાસીને સામાન્ય વાચકને અનુકૂળ પડે એવી નાની ચોપડી. એટલે પછી ‘વિવિધ વારૂતાલાપો’ના મુખ્ય વિશય બની ગયેલા એવા ગાંધીજી વિશેનો ભાગ તેમાંથી તારવી લીધો. શરી અનુમાંશંકરભાઈએ કહ્યું છે કે, “કાકાસાહેબે ગાંધીજી વિશે જીવનભર પુશ્કળ લખ્યું છે. પણ આ વારૂતાલાપોમાં ગાંધીજી પર્ત્યે એમનું જે વાત્સલ્ય પ્રગટ થાય છે, એવું ક્રયાંય પ્રગટ થયું નથી.” એમતરબોળ હુરુદ્ધયથી કાકાસાહેબે કરેલાં એવાં અન્ય થોડાં લખાણો ‘રંથાવલિ’ અને બીજેથી સહેજે મળી શક્યાં તે અનુમેરીને આ પુસ્તકા તૈયાર કરી છે.

શરી કિશોરલાલ મશરૂવાળાએ છાએક દાયકા પહેલાં ‘ગાંધીવિચારદોહન’ પુસ્તક તૈયાર કર્યું, તેના નિવેદનમાં એમણે લખ્યું છે તે આ ચોપડીના વાચકો પાસે પણ મૂકવા જેવું છે :

ગાંધીજીના લેખોમાં સ્પશ્ટપણે નથી એવું ઘણું આ પુસ્તકમાં છે, એવું ઘણાને લાગશે. હું એમ માનું છું કે કોઈ સત્યરૂપના વિચારોને માત્ર એમનાં પુસ્તકોના અભ્યાસથી પૂરેપૂરા નથી જાણી શકતા; એમનો સહવાસ જોઈએ. સહવાસ અધરાંત એમનું હુરુદ્ધય સમજવાનો અને એમની સમગ્ર વિચારસરણીના મૂળ પાયા પકડવાનો પ્રયત્ન હોવો જોઈએ. એ પાયા જો હાથ

લાગે, તો એમની આખી વિચારસુશ્પિટિ, જેમ ભૂમિતિમાં એક સિદ્ધાંતમાંથી બીજા સિદ્ધાંતો નીકળે છે તેમ, દેખાતી આવે. ગાંધીજીને સમજવાનો મારો પ્રયત્ન આ રીતનો છે.

કાકા કાલેલકરના અહીં રજૂ થતાં લખાણમાં પણ એ કોટિનો એક પ્રયત્ન આપણને જોવા મળશે. વળી ગાંધીજીના જીવનના વિવિધ પ્રસંગોમાંથી એમના વિચારો અહીં ઔપસે છે, અને કાકાસાહેબની સમરૂથ વાણીમાં તે આલેખાયેલા છે, એટલે તેનું વાચન અત્યંત રસિક બને છે.

જેમ ગાંધીજી સાથેના કાકાસાહેબના સહવાસનો અને એમનું હુરુદ્ય સમજવાના પ્રયત્નનો, તેવી રીતે ખુદ કાકાસાહેબનું હુરુદ્ય સમજવાના ભાઓ રવીન્દ્ર કેળેકરના પ્રયત્નનો લાભ પણ આપણને અહીં મળે છે. આ પુસ્તકના લગભગ અરધા ભાગ જેટલું લખાણ એમના ‘વારૂતાવાપો’માંથી તારવવાની સંમતિ આપવા બદલે એમનો હાર્દિક આભાર માનું છું. એમણે ટાંકેલી કાલેલકર-વાણી અધરાંત સીધા કાકાસાહેબનાં જ પુસ્તકોમાંથી લીધેલા અંશો અહીં શામેલા કરવાની રજા આપવા બદલ નવજીવન ટ્રસ્ટનો પણ આભાર માનવાનો છે.

ભારતને સ્વરાજ મળ્યાને હમણાં પચાસ વરસ પૂરાં થયાં. એ સ્વરાજની મંજિલ સુધી આપણને અખૂટ પેમ અને ધીરજથી દોરી જનાર રાશ્ટ્રપિતાને સ્વતંત્રતાના સૂર્યોદયની ઘડીએ જ આપણે ખોઓઓ બેઠા, તેને પણ અરધી સદી વીતવા આવી. હિમાલયના અનુતુંગમાં અનુતુંગ શિખર સમા અદ્ભુત એમના જીવનનું અને એવા જ ભવ્ય એમના વિચારોનું જરીક દરૂશન પર્વતાવિરાજ ગાંધીની આસપાસની શિખર-મંડળી પૈકી એકની અધર ઔભાં રહીને જાણે કરતાં હોઅઓએ, એવી ધન્યતાનો અનુભવ કાકાસાહેબની આ ચોપડી વાંચ્યતાં થશે, એવી આશા છે.

અશુ જ્યંતી, 1997

મહેન્દ્ર મેધાણી

કાકા કાલેલકર અને કિશોરલાલ મશરૂવાળા જેવા વિદ્વાન કેળવણીકારોએ પ્રબોધીલી લિપિ-સુધારણાનો અમલ લોકમિલાપનાં પ્રકાશનોમાં થાય છે. તેની વિગતવાર સમજણ આપતી પુસ્તક વિનામૂલ્યે આ સરનામેથી મળશે :
લોકમિલાપ, પો. બો. 23, ભાવનગર 364001.

જીવનરસથી ભર્યું ભર્યું

દુનિયાના સાહિત્ય-બિત્તિધારોમાં સ્વભાશા સિવાયની ભાશાના સાહિત્યમાં અમર સ્થાન મેળવનારાઓનાં ગણ્યાંગાંધ્યાં દ્રુષ્ટયાંતો મળે છે. કાકાસાહેબ તેમાંનું એક છે. જન્મે મરાઠીભાષી કાકા કાલેલકર ગુજરાતી ભાશામાં અમર રહેશે.

એમનાં લખાણો ન વાંચ્યાં હોય એવો ભાજ્યે જ કોઝી ગુજરાતી સાહિત્યપ્રેમી હશે. એમનાં હિમાલય અને બ્રહ્મદેશના પ્રવાસનાં વર્ણનો, હિંદુની નદીઓનું આપસ્થાન કરતો ‘લોકમાતા’ નામે રસપ્રવાહ, કીડી મંકોડા ને કાગડા-બિલાડા, ઝાડ-પાંડડાં ને વાદળ-તારા જોડેની ગોઠડી વર્ણની ઓતરાતી દીવાલો’, શૈશવકાળનાં બહુરંગી પરાક્રમો અને તોણનો સુરેખપણે રજૂ કરતી ‘સ્મરણયાત્રા’—એ બધાં પુસ્તકો ગુજરાતી-પ્રેમીઓનાં માનીતાં થયી પડ્યાં છે. કાકાસાહેબનો સર્વવાનુમતે ગૌરવરંથ ‘જીવનનો આનંદ’ પ્રકૃતિ વિશેના લઘુનિબંધોનો સંગરહ છે. એમનું કેટલુંક લખાણ અત્યંત સમુદ્ધ એવા ગુજરાતી ગદ્યના એક સુચારુ શિખર સમું દીપી રહેશે.

‘આપણી કવિતા-સમુદ્ધિ’ના પ્રવેશકમાં નરમદથી શરૂ થતા અર્દ્વાચીન ગુજરાતી સાહિત્યના દસ અનુત્તમ ગદ્યકારોનાં નામ બ. ક. ઠાકોર 1930માં ગણાવે છે. એમણે મહાન સાફ્શર ગદ્યકારોનો અલ્લેખ તો કર્યો જ, પણ તે સાથે મહાત્મા ગાંધી આપરાંત એમના સાથીઓમાંથી કાકા કાલેલકર અને કિશોરલાલ ઘ. મશરૂવાળાનાં નામ આપ્યાં.

*

કાકાસાહેબનું ગદ્ય પ્રકૃતિચિત્રણમાં અને પ્રવાસવર્ણનમાં અપૂર્વ સર્જકતાથી ખીલી અઢે છે. ભૂગોળના રસીયા તેવા જ ખગોળની સૌંદર્યસમુદ્ધિના પણ તરસ્યા. ભારતયાત્રી કાલિદાસ પછી સ્વદેશની પ્રકૃતિશરીનું આકંઈ પાન કરનાર અને એને શબ્દબદ્ધ કરનાર કાકાસાહેબ જેવા ઓછા જ પાક્યા હશે. એમનું ગદ્ય અનેક વાર કાવ્યની કોટિએ પહોંચે છે.

આપણા સાહિત્યમાં કાકાસાહેબનું નામ ચિરંજીવ રહેશે. ગુજરાતી ગદ્યનો જે અદ્ભુત વિકાસ થયો છે, તેમાં કાકાસાહેબનો ફાળો ગુણવત્તા અને જરૂધાની દુરુશિયે વિપુલ છે. ગુજરાતી ભાશાનો એકનો એક જોડણીકોશ તૈયાર કરવા પાછળ વપરાયેલી એમની શક્તિ અવિસરણીય રહેશે. ગુજરાતીઓ એમને એક જંગમ વિદ્યાપીઠ તરીકે ઓળખે છે.

ગાંધીજીએ દક્ષિણ આફ્રિકાથી સ્વદેશ પાછા ફરી, 1915માં ગુજરાતમાં આશરમ

સ્થાપીને રાશ્ટ્રમુક્કૃતિની લડતને વેગ આપવા માંડ્યો, ત્યાં દેશમાંથી અનેક તેજસ્વી યુવકો આવીને એમની સાથે જોડાયા. ત્વીસ વરસના દત્તાત્રેય બા. કાલેલકર કવિવર રવીન્દ્રનાથના શાંતિનિકેતનમાં અધ્યાપનકાર્ય કરતા હતા. ત્યાં જ એમને ગાંધીજીનો ભેટો થયો અને એમની ઘર્યે તેઓ આકર્ષણાયા, અને પછીથી અમદાવાદ જાઓને રહ્યા. ગાંધીજીના નિકટના અંતેવાસી અને રાશ્ટ્રીય શિક્ષણના એક મુખ્ય સાથી એ બની રહ્યા.

ગુજરાતમાં સાબરમતી આશરમમાં નાનાં બાળકોને ભણાવવા માંડ્યું, એટલે કાકાસાહેબની સરરસ્વતી ગુજરાતી દ્વારા વહેવા માંડી. ‘હિમાલયનો ઘ્રાવસ’ બાળકો આગળ અનેક વાર કહેવાયો, પછી શબ્દબદ્ધ થયો. ‘સ્મરણયાત્રા’ના ઘ્રસંગોના પણ પહેલા આસ્વાદકો આશરમશાળાના નાના વિદ્યાર્થીઓ. આશરમની ચુત્તરે આવેલી સાબરમતી જેલની મહેમાનગતિ પછી ‘ઓતરાતી દીવાલો’ની આનંદકહાળી લખી, એ તો ગાંધીજીની પરિય થચી પડી. ગુજરાતી પોતાની માત્રુભાશા ન હોવા છતાં તેની સુંદરતા અપૂર્વ રીતે બહાર લાવતા અને પોતાની સારરસ્વત મોહિનીથી ગુજરાતના સંસ્કારજીવન અનુપર છાઓ જતા કાકા કાલેલકરને ગાંધીજીએ સવાઓ ગુજરાતી તરીકે બિરદાવ્યા.

*

જીવાનીમાં હિમાલયમાં સ્વામી આનંદ, અનંત બુવા મરછેકર અને (વચ્ચે વચ્ચે જોડાતા) જીવતરામ ફુરુપાલાની જેવા સાથીઓ સાથે બે હજાર કરતાં વધુ માઝીલો પર્યાટન કરી જાણે કે ભારતીય સંસ્કૃતિના મંદિરના ગરૂભગુહમાં એકધ્યાન રહ્યા.

કેળવણીકાર અને સ્વાતંત્ર્ય-યોદ્ધા તરીકે પોતે આપણા આ વિશાળ દેશના અંંગ ઘ્રવાસી હોવા છતાં, સ્વરાજ ન મળે ત્યાં સુધી વિદેશયાત્રાનો સ્વેચ્છાથી નિશેધ પાળ્યો. પણ સ્વરાજ મળ્યા પછી દુનિયાના ખૂણેખૂણે ઘૂમ્યા.

કાકાસાહેબે લખ્યું ખૂબ, છતાં પૂછો તો કહેશે કે પોતે સાહિત્યકાર થવા કશું કરતા નથી, જીવવાના ભાગરૂપે સહજપણે લખવાનું આવે તો તે લખે છે. એમને સાહિત્યના બે સહજ પ્રકારો — પત્રલેખન અને વાસરી — માટે સંવિશેશ આરસ્થા હતી. પત્ર એ અન્ય માનવબંધુ સાથેનો અપ્રત્યક્ષ વાર્તાલાપ છે, તો વાસરી એ અંતર્યામી સાથેની પ્રત્યક્ષ વાતચીત છે. બંને પ્રકાર કાકાસાહેબના હાથે અઠળક જોડાયા. હજારો પત્રો એમણે લખ્યા.

એક શિક્ષણક અને ચિંતક તરીકે કેળવણી, સમાજ, સંસ્કૃતિ અને ધરૂમનાં વિવિધ પાસાં અનુપર સતત એ લખતા રહ્યા. આ સદીના ત્રીજાથી પાંચમા દસકામાં કેટલી તો ઘ્રસ્તાવનાઓ એમણે લખી !

એક સાહિત્યકાર—ગદ્યકાર તરીકેની એમની બે લાકુશણિકતાઓ ધ્યાન જેંચે છે.

એક તો સૂત્રાત્મક સૂક્ષ્મતિઓ સહજપણે અદ્વારવાની, અને બીજી નવા શબ્દો અપજવવાની.

નવા શબ્દો નિપજાવવાની તો કાકાસાહેબે કહો કે ટંકશાળ ખોલી હતી. શબ્દોનો એમને સ્વાદ હતો. નામો પાડવાની કાકાસાહેબને ફાવટ હતી..

પારિભાષિક શબ્દો યોજવામાં કાકાસાહેબ એકુકા ગણાય છે, Printer's Devil માટે 'મુદ્રારાક્ષણસ', એવા તો એમને નામે સહેજે હજારેક શબ્દો થાયી ગયા હશે. ગુજરાતીઓએ એમાંના ઘણાખરા તો ચલણી બનાવી દીધા છે, એ જ એની યોગ્ય કદર છે.

*

કાકાસાહેબ માણસભૂભ્યા, ગોશઠિના માણસ. કાકાસાહેબનું આત્મમ વાતચીતમાં ઘગટ થતું. અખૂટ જીવનરસ, અત્યંત કુશાગ્ર બુદ્ધિ, અદ્ભુત વિનોદવૃત્તિ, વસ્તુને વિશાળ સંદર્ભમાં જોવાની ફાવટ—આ બધાંને લીધે કાકાસાહેબનું સભર વ્યક્તિત્વ વારતાલાપમાં અપૂર્વ રમણીયતાથી ઔદ્ઘડતું.

આવું ભર્યું ભર્યું અસ્તિત્વ—પંચાણું વરસ ચાલેલું વીર, આરૂશ જીવન ગુજરાતી ભાષા દ્વારા તેજસ્વી રીતે અભિવ્યક્ત થતું રહ્યું. ગાંધીજીના અવતારકાર્યના એક સહયોગી, રાશ્ટ્રરીય આત્માનના કર્મચારી લડવૈયા, દેશના ખૂણેખૂણાના અનેક જીવનસાધકોના અને સંસ્થાઓના પેરણામૂર્તિ, દેશવિદેશમાં અનેક કુટુંબો, સમાજોમાં આશ્મા અને પ્રકાશની લહાણ કરતા વત્સલ ગુરુજન—કાકાસાહેબ કાલેલકરનાં આ વિવિધ પાસાં સમય જતાં સ્મૃતિશોશ થશે. રહેશે એમનો લેખનરાશિ અને એની દ્વારા પમરતું એમનું અનોખું માનવવ્યક્તિત્વ.

આમાશંકર જોશી

[‘સર્જકપત્રિભા’(2)માંથી સંકલિત]

આધુનિક ભારતની સાધના

કોઓ મહાનુભાવના અંતેવાસી બની વાર્ષતાલાપો કરવા અને તે શબ્દબદ્ધ કરવા : આ પ્રકારનું પુસ્તક લખવું ખરેખર કસોટીરૂપ બની રહે. અંતેવાસીનું હુરુદ્યમુકુર સ્વચ્છ જોઓઓ, સ્પશ્ટ સુરેખ છબી આપસાવી શકે એવું.

આવી કસોટીમાં કોઓ લેખક સહેજે આત્મિરૂણ થતા જોવા મળે છે. જીહોન્સનના અંતેવાસી બોસ્ટેલ નાનીમોટી, ગંભીર-અંગંભીર અનેક વસ્તુઓ ટપકાવ્યે ગયા. એ ટાંચણો બની ગયાં દુનિયાનો એક ગૌરવરંથ.

જરૂરમન મહાકવિ જ્યુઅથેની બુદ્ધાવસ્થામાં એકરમેન નામના એમના એક ચાહકે એમની સાથે કરેલા વાર્ષતાલાપો નોંધી લીધા. એ એવો સમુદ્ધ જરૂર બન્યો કે જરૂરમન તત્ત્વજ્ઞ નિત્યોએ જ્યુઅથેની કોઓ સર્જક ફુરુતિનું નહિ પણ આ “વાતચીતો” નું “જરૂરમન ભાશામાં મારા વાંચવામાં આવેલું શેરેશ પુસ્તક” એ શબ્દોમાં બહુમાન કર્યું છે.

મહેન્દ્રરનાથ ગુપ્તે શ્રીરામકૃતુશણ પરમહંસનાં અને મહાદેવભાઓ દેસાઓએ મહાત્મા ગાંધીનાં વચનો અને પ્રસંગો ટપકાવી લીધાં, એ એમનો માનવબંધુઓ આપર કેવડો મોટો આપકાર થયો છે ! આ પુસ્તકોનું મુખ્ય આકર્ષણ તે પુસ્તકોનો વિશય બનેલી વ્યકૃતિ છે. લખનારનું તો લગભગ આત્મવિલોપન થતું હોય છે. અને તેમ છતાં લખનારનું માપ આપણને મળ્યા વગર રહેતું નથી.

ભાઓ રવીન્દ્ર કેળેકર કોંકણી-મરાಠીનાં લેખક છે. વરસોથી તે કાકાસાહેબને આત્મીયતાથી ઓળખે છે. આધુનિક ભારતના અભિખાસના તારતાર સાથે આત્મીયતાથી જોડાયેલી કાકાસાહેબ જેવી વયોવુદ્ધ સાંસ્કૃતિક વ્યકૃતિનું ચિંતન સુરેખ રીતે મેળવવું એ આશય આ વાર્ષતાલાપો પાછળ જોઓ શકાય.

પણ વાતચીત કાકાસાહેબમાં સીમિત રહેતી નથી. તરત જ મુખ્ય વિશય ગાંધીજી બની જાય છે. કાકાસાહેબે ગાંધીજી વિશે જીવનભર પુશ્કળ લાખ્યું છે. પણ આ વાર્ષતાલાપોમાં ગાંધીજી પ્રત્યે એમનું જે વાત્સલ્ય પ્રગટ થાય છે એવું ક્રયાંય પ્રગટ થયું નથી. એ વ્યકૃતિ પ્રત્યે છે તે કરતાં એક અજોડ જીવનસાધના પ્રત્યે વધુ છે. સૂક્ષ્મ રીતે એ સાધનાને સમજવાનો પર્યાલ કરતાં હુરુદ્ય પ્રેમતરબોળ બને, એનો અનુભવ કાકાસાહેબના ગાંધીજી વિશેના અદ્રગારો કરાવે છે.

19-2-1971

અમાશંકર જોશી

[‘કાકા કાલેલકર સાથે વિવિધ વાર્ષતાલાપોના પ્રવેશકમાંથી ટૂંકાવીને]

દોહન કરનાર નીકળશે

મિન્ન મિન્ન વખતે લખેલા લેખોનો સંગરહ છપાવતી વખતે
એમાં કાટછાંટ કરીને પુનરૂક્તિ ટાળવાનો મારો ધર્મ હતો.
તેનું પાલન કરવા જેટલી નવરાશ મને નથી.
અને છતાં એ સંગરહ છપાવવા જેટલો આત્માહ છે.
આશા રાખી હતી કે કાટછાંટ કરીશ,
ફકરાઓ એક વિશિષ્ટ અનુક્રમ પ્રમાણે ગોઠવીશ.
પણ હવે જોઅંદું છું કે કામો વધે છે
અને શારીરિક શક્તિ આંદોલની ઘટે છે.
હજી વાંચવાનું ઘણું છે.
વિચારવાનું એથીયે વધારે છે.
ફલાણું લખીશ, ઢીંકણું લખીશ,
એવા કરેલા સંકલ્પોનો ઠગલો અંચો થતો જાય છે.
એટલે જૂનું સમારવાનું અને સુધારવાનું કામ હું કરી શકીશ,
એની આશા ઓછી થતી જાય છે.
આ લખાણોમાં કાંચીક ગરાહ્યાંશ હશે,
તો એનું દોહન કરનાર કોચીક તો નીકળશે જ.

કાકા કલેલકર

ગાંધીજીને “લોન”

પહેલાં હું ફરાંતિકારી દળમાં હતો. ફરાંતિકારી નેતાઓની દેશભક્તિ અજૂજૂવળ હતી. ત્યાગ અને બવિદાન માટે તેઓ હંમેશા તૈયાર રહેતા. ફાંસીએ ચડવાની તૈયારી. પણ અંગેજોનો મુકાબલો કરવો હોય તો આપણી તૈયારી કેટલી હોવી જોઓએ, એનો હિસાબ નેતાઓ પાસે નહોતો. લોકજાગ્રંથિત માટે શું કરવું જોઓએ, એનો અંદાજ એમનામાં ન હતો. સરકારે નેતાઓને સખત સજાઓ કરી, અને કઠીરતાથી પ્રજાને દબાવી દીધી. મેં જોયું કે કોણી પણ રાજ્યદ્વારી પદ્ધતિની અસર જનતા પર ખાસ દેખાતી નથી. લોકો અસંતોશ કેળવે છે, પણ શક્કતિ કેળવતા નથી.

મારા પર વેદાન્તનો પ્રભાવ હતો. સંતસાહિત્યનો પણ પ્રભાવ હતો. દેશમાં કશું નફકર કરવાની આશા જ્યારે દેખાઓ નહીં, ત્યારે આધ્યાત્મિક પેરણા મેળવવાની અને પ્રજાહૃદાદ્ય ઓળખી એના પર અસર કરવાની યોગ્યતા મળે એ અિચ્છાથી હું હિમાલયમાં ગયો. હિમાલયમાં કુદરતની ભવ્યતાનાં દર્શન કરતાં કરતાં હું આધ્યાત્મિક સાધના તરફ વળ્યો.

પણ એક સંકલ્પ મને બાકીનું જીવન પૂરું કરવા પાછો લાયો. એ સંકલ્પ હતો ભારતમાતાની સ્વતંત્રતાનો. ભારતમાતાને ગુલામીમાંથી મુક્કતિ ન મળે ત્યાં સુધી મને પોતાને મોક્ષ મળે તોયે મારે એ માણવો નહોતો. મારામાં એક વિચાર મજબૂત થયો હતો કે સમસ્ત પ્રજામાં રાશ્ટ્રરીય કેળવણી દ્વારા આધ્યાત્મિક તેજ પેઢા કર્યા વગર પ્રજાકીય અનુથાન શક્ય નથી.

એ અરસામાં રવીન્દ્રનાથ ઠાકુરના કેળવણી-વિશયક અને આધ્યાત્મિક વિચારોનો રંગ પણ મને લાગ્યો હતો. મેં રવિબાબુને પત્ર લાગ્યો કે, “હું રાશ્ટ્રરીય શિક્ષણનો પેમી છું. ચાર-છ મહિના શાંતિનિકેતનમાં રહી આપના શિક્ષણના આદર્શનું અને પદ્ધતિનું અધ્યયન કરવાની મારી અિચ્છા છે.” રવિબાબુનો તરત જવાબ આય્યો : “આવો.”

1915માં ગાંધીજી આફ્રિકાથી હિંદુસ્તાનમાં આવ્યા, અને શાંતિનિકેતનમાં હું એમને મળ્યો. એમની સાથે ઘણી ચર્ચા કરી. એમાં મેં કહ્યું : “આપની તેજસ્વિતા અને કાર્યકુશળતાથી હું પ્રભાવિત થયો છું. પણ અહિંસા દ્વારા ભારતને સ્વરાજ્ય મળી શકશે, એ વિશે વિશવાસ બેસતો નથી. દેશને ગુલામીમાંથી મુક્કત કરવા માટે શસ્ત્રયુદ્ધ પણ કરવું પડશે, એમ હું માનું છું.”

ગાંધીજીએ એટલું જ કહ્યું, “તમે મારી પાસે આવો. હું આશરમ ખોલવાનો છું, એમાં રહો. મારી કાર્યપદ્ધતિ સમજી લો. વિશવાસ જામે તો રહો, નહીં તો મને છોડીને ચાલ્યા જાવ.”

છેલ્લે, મેં દલીલ કરી, “અહિંસા પર્ત્યે મારા મનમાં આદર છે, પણ મેં એ સ્વીકારી નથી. એવા માણસને આશરમમાં લખી શકશો ખરા ?”

એમણે હસ્તીને કહ્યું, “આજે દુનિયામાં તમારી બહુમતી છે. હું અલ્યમતીમાં હું. તમારા જેવાનો ત્યાગ કરું, તો મને સેવક ક્યાંથી મળવાના ? અહિંસાની શક્તિ વિશે તમારામાં વિશ્વાસ પેદા કરવો, એ મારું કામ છે.” એ જવાબથી હું માત થયો.

મારા ફરાંતિદળના સાથી કરુપાલાની તે વખતે મુઝફફુરપુરની કોલેજમાં અધ્યાપક હતા. મેં તાર કરીને એમને પણ ગાંધીજીને મળવા બોલાવી લીધા. એમણે પણ ગાંધીજી સાથે ખૂબ ચર્ચા કરી, વાંકાચૂંકા અનેક પ્રશ્નો પૂછ્યા. ગાંધીજીએ એમને વ્યવસ્થિત જવાબો આપ્યા. કરુપાલાનીએ છેલ્લે કહ્યું, “હું અનિહાસનો અધ્યાપક હું. અહિંસા દ્વારા રાશ્ટ્ર સ્વતંત્ર થયાનો એક પણ દાખલો મને મનુષ્યજ્ઞતિના અનિહાસમાં મળ્યો નથી.”

જાણે કોણી સામાન્ય વાત બોલતા હોય એમ ગાંધીજીએ અત્યંત નમ્રતાપૂર્વક પણ તેટલા જ આત્મવિશ્વાસથી અનુત્તર દીધો : “તમે અનિહાસ શીખવનારા છો, હું અનિહાસ ઘડનારો હું. અહિંસક પરતિકાર દ્વારા આપણે ભારતને સ્વરાજ્ય મેળવી આપીશું. પછી અનિહાસના અધ્યાપકો એના પર વ્યાખ્યાનો આપશો.”

કરુપાલાની પણ મારી પેઠે ગાંધીજીના થઅની ગયા. પહેલી મુલાકાતમાં જ મારા પર એવી છાપ પડી કે બધા પ્રશ્નો પર ગાંધીજીએ આંડો વિચાર કરેલો છે. મને લાગ્યું કે સ્વરાજ્યનો આપણો સંકલ્પ પૂરો કરવા માટે એમનું નેતૃત્વ પરસ્યાપ્ત છે.

*

ગાંધીજીના ગયા પછી હું રવિબાબુ પાસે ગયો. મેં કહ્યું, “ગુરુદેવ, આપના જીવન વિશેના તત્ત્વજ્ઞનથી હું પ્રભાવિત હું. આપે મને અહીં કાયમ રહેવા માટે કહ્યું, અને તે માટે હું લગભગ તૈયાર પણ થઅની ગયો. પણ હમણાં હમણાં ગાંધીજી સાથે મારે ઘણી ચર્ચા થઅની. હવે મને લાગે છે કે જે સ્વરાજ્યની મને ભૂખ છે, તે ગાંધીજીના પરયન્થી વહેલું મળશે. હું ગાંધીજી પાસે જાઓ, તો આપ મને આશીર્વાદ આપશો ને ?”

ગુરુદેવે “ભલે” કહ્યું. પાછળથી ખબર પડી કે એ પહેલાં જ ગાંધીજીએ એમની પાસે મારી માગણી કરી હતી, અને ગુરુદેવે મને “લોન” તરીકે ગાંધીજીને આપવાનું કબૂલ્યું હતું.

રાશ્ટ્રરીય એકતાને વિધાતક એવી જે સૈકાઓ-જીની નબળાઓઓ દેશમાં ફેલાઅની હતી તે દૂર કરવાનું ભગીરથ કામ ગાંધીજીએ પોતાના આશરમ મારફત ચલાવ્યું. સમાજમાં ફેલાયેલી હીનબુતિઓ, ભિન્ન ભિન્ન વર્ગોનું અણગાપણું, સંકુચિત સ્વાર્થ અને પરસ્પર

અવિશ્વાસ દૂર કરવાના કાર્યક્રમો એમણે ચલાવ્યા. અહિંસાની શક્તિ વિશે અને સત્યાગ્રહ પાછળ કેળવાતા કુશાત્રતેજ વિશે મારો વિશ્વાસ દૂરુઠ થતો ગયો.

આગળ જતાં એક વાર ગુરુદેવ સાબરમતી આશરમમાં આવ્યા ત્યારે એમણે કહ્યું : “ગાંધીજીએ મારી પાસે ‘લોન’ મારી, પણ તે પાછી આપવાની વાત જ કરતા નથી !”

*

યુદ્ધધીયે વધારે હિંસા

ગાંધીજીએ અનેક વાર કહ્યું હતું : “હું યુદ્ધવિરોધી છું. પણ સર્વત્ર મનુશ્યજાતિમાં જે શોશણ ચાલી રહ્યું છે, એનાથી જેટલો ડરું છું તેટલો યુદ્ધધીય હું ડરતો નથી. યુદ્ધ તો વખતોવખત ફાટી નીકળનારો એક રોગ છે. પણ દિવસરાત અખંડ ચાલનારા સાર્વભૌમ શોશણથી વધારે કોઓ હિંસા છે જ નહિ.”

પુરુષજાતિ સ્તરીજાતિનું શોશણ કરે છે. જનાની અને ચતુર લોકો અજનાની અને અસહાય લોકોનું શોશણ કરે છે. આજકાલનાં બધાં સંગઈન શોશણને પૂરી સહૃણતા અપાવવા માટે જ ઔભાં કરવામાં આવ્યાં છે. જે કોઓ લોકો અસંગઠિત હોય, એમને તો જીવન-સંગરામમાં હારવું જ પડવાનું.

માણસને પરિશરમ ટાળવો છે અને આરામથી વિલાસી જીવન જીવવું છે. બીજાના પરિશરમનો ગેરકાયદો અનુઠાવી પોતે ધનવાન બનવું છે, અને ગરીબી ને બેકારી બીજી વ્યક્તિ કે બીજા સમાજને માથે ઢોળવી છે. આ જ છે પાપમૂલક શોશણનું આકર્ષણ. આવા આકર્ષણથી મુક્ત એવું એક પણ રાશ્ટ્ર નથી. આવા અન્યાયને દૂર કરવાનો અહિંસક અલાજ એક જ છે—સમાજવ્યાપી કેળવણીમાં પરિવર્તન.

*

બહારવટિયા પાસેથી મળેલી સૂઝ

ગાંધીજી ભારત આવ્યા ત્યારે પૂરું એક વર્ષશ દેશનું નિરીક્ષણ કર્યા પછી એમણે ભારતની રાજનીતિમાં પરવેશો કર્યો. જોતજોતામાં તેમની તેજસ્વિતા પ્રગટ થઅની. ગાંધીજી કોંગ્રેસના નેતા થયા. પ્રજામાં અસાધારણ જાગૃતિ અનુપન્ન થઅની.

એક વખતે હિંસામાં માનનારા અમે ફરાંતિકારી જુવાનો ફ્રયારેક ભેગા થયા હતા. ગાંધીજીના પદ્ધતિમાં હું ભળી ગયો, તેનું એમને આશ્ચર્ય થતું હતું ! કેટલાક કહેતા, “કાલેલકર લુચ્યો છે. ગાંધીજીની સાથે રહીને અહિંસાની વાતો કરવા લાગ્યો છે. આ રીતે સરકારની નજર ચૂકવી શકશે. પણ અંદરખાનેથી તો કાલેલકર આપણો જ છે. જેમ સરકારને બનાવે છે, તેમ ગાંધીજીને પણ બનાવે છે.”

આ જુવાનો બધા મારા જૂના સાથીઓ. મારા અસુપર એમનો વિશ્વાસ પૂરો. એટલે મેં એમને સાફ કહ્યું, “ભાસીઓ, હું તમારો જ માણસ છું. ફરાંતિમાં પૂરેપૂરો માનું છું. પણ અનુભવે ગાંધીવાદી થયો છું. હું ગાંધીને બનાવતો નથી. ગાંધીજીના વિચારો સમજીને હુરુદ્યથી મેં સ્વીકાર્યા છે. સરકારને છેતરવા માટે મેં અહિંસા ઓઢી નથી. અહિંસામાં ફ્રશાત્તરેજ પ્રગટ થઅની શકે એની ખાતરી થવાથી જ ગાંધીવાદી થયો છું. હવે મારી વાત સાંભળો—

“આપણે હિંસામાં માનીએ છીએ. મહામુશકેલીએ આપણે થોડાં શસ્ત્રો ભેગાં કર્યાં. બંગાળના આપણા ભાસીઓએ રાજ્યદ્વારી ખૂન કર્યાં. પરિણામ શું આવ્યું ? સરકારને તક મળી. પ્રજાને દબાવવામાં સરકારે મણા રાખી નથી.

“લોકો આપણી કદર કરે છે. આપણી દેશભક્તિને પૂજે છે. પણ સામાન્ય પ્રજા, વિશાળ પ્રજા આપણે રસ્તે આવવાની નથી. મારફાડ કે ખૂનરેઝીનો રસ આપણી પ્રજામાં છે જ નહિ. એને સ્વભાવની મોળાશ કહો કે સંસ્કુરુતિની અંચાઅી કહો. સ્વભાવ એ સ્વભાવ જ છે. એ સ્વભાવની અંદરથી ગાંધીજીએ આપણી પ્રજાની સંસ્કુરુતિને અનુરૂપ એવો લડાચીનો એક માર્ગ અપજાવી કાઢ્યો છે.

“જૂયાં આપણે અંગરેજ રાજ્યકર્તા સામે આખી પ્રજાને અશુકેરી શક્યા નથી, લડવા તૈયાર કરી શક્યા નથી, ત્યાં ગાંધીજી ફાંચી ગયા છે. કોઓને મારો નહિ, મકાનો બાળો નહિ, અને છતાં સરકારનું કામ અટકી પડે એવું પગલું ભરો, અને પ્રજા પાસે તે અમલમાં મુકાવો. એ “લશકરી લડાયક પદ્ધતિ” શું મામૂલી છે ? જૈનો અહિંસાનો પ્રચાર કરે છે. વૈશણવો પણ અહિંસાને વરેલા છે. પણ ગાંધીજીએ અહિંસામાં જે ફ્રશાત્તરેજ દાખલ કર્યું

છે તે અનોખું છે. એ સૂજ એમને સૌરાશ્ટ્રના બહારવટિયા પાસેથી મળી હુશે. પણ એ કળાને ગાંધીજીએ અધ્યાત્મ અને યુદ્ધનીતિ બંનેની દીક્રિયા આપી છે. આપણે જો એની એ ખૂબી સમજી ન શકીએ, તો આપણે ફરાંતિકારી શાના ?

“આ ગાંધીપદ્ધતિની યુદ્ધનીતિ આપણી સંસ્કૃતિને અત્યંત અનુકૂળ છે અને આજના યુગમાં ફાવે એવી છે, એટલે સ્વાતંત્ર્યના એક સેનાપતિ તરીકે ગાંધીજીની પાદળ પાછળ જવાનું મેં નક્કડી કર્યું છે.”

*

સામા માણસ પર વિશ્વાસ

સત્યનિશ્ચ માણસમાં સામા માણસના વચન પ્રત્યે શંકા ન લાવવાની આસ્તિક્તા હોય છે. અને સાથે સાથે કોઓ પણ વસ્તુ પૂરતા પુરાવા વગર ન સ્વીકારવાનું ચોક્કસપણું પણ હોય છે.

ગાંધીજીમાં એવી સત્યનિશ્ઠા હતી. તેથી તેઓ એકબાજુ આપણા રુશિમુનિઓનાં અને સાધુસંતોનાં વચનો અનુપર અગાધ વિશ્વાસ રાખતા હતા; એ વચનો પ્રમાણે પોતાનું જીવન ઘડવામાં એમના મનમાં જરાય આનાકાની રહેતી નહિ. અને બીજી બાજુ દરેકેદરેક વસ્તુ જીવનની કસોટી અનુપર કર્યા વગર આગળ જવાય જ નહિ, એવો એમનો સ્વભાવ થયો હતો.

તેઓ સામા માણસની દાનાઓ અનુપર અને એનાં વચનો અનુપર પૂરો વિશ્વાસ રાખતા. તેઓ કહેતા કે, “જો આપણે અન્યથા હોઓએ કે આપણા વચન અનુપર લોકો વિશ્વાસ રાખે, તો આપણે પણ સામા માણસના વચન અનુપર વિશ્વાસ રાખવો જોઓએ. સામો માણસ જો ફરી જાય અને આપણને છેતરે, તો એ જેટલી વાર છેતરે એટલી વાર સત્યાગરહ કરવા માટે આપણે તૈયાર છીએ.”

*

ગાંધીજીનું ઘડતર

ગાંધીજીના ઘડતરમાં સહુથી મહત્વની અસર સૌરાશ્ટ્રની વિશિષ્ટ સંસ્કૃતિની પડી છે. સૌરાશ્ટ્રે એક એવો વિશિષ્ટ વરૂગ નિરૂપાણ કર્યો કે જેના પર સૌરાશ્ટ્રની પ્રતિભાની જલક દેખાઓ આવે છે. જ્યારે એકાદ તેજસ્વી પુરુષ પોતાના રાજાની સામે થાય છે, ત્યારે સ્વેચ્છાએ પોતાનું નાગરિકત્વ છોડી દઈ એ પોતાને રાજ્યતંત્રના વિરોધી તરીકે જાહેર કરે છે. રાજાને એ સંદેશો મોકલે છે કે, હવે હું તમારો પ્રજાજન નથી. હવે તમને અને તમારી પ્રજાને હું ત્રાસ આપતો રહીશ, રંજાડીશ. તમારી પ્રજાને પણ ખબર પડવી જોએ એ કે રાજ્યરક્ષણાની શકૃતિ તમારામાં નથી.

રાજ્યશકૃતિને આવો પડકાર, એ તેજસ્વી પુરુષોનું કામ છે. તેઓ હથેળીમાં માથું લખીને જ ફરતા. સૌરાશ્ટ્રમાં આવા લોકોને બહારવટિયા કહે છે. ત્યાંના લોકકવિઓએ એમનાં કાવ્યમય વરૂણનો લખ્યાં છે. સૌરાશ્ટ્રના લોકમાનસમાં બહારવટિયા તેજસ્વી, દ્વિલાવર અને લોકપરિય મૂર્ખતિ બનીને રહ્યા છે.

સૌરાશ્ટ્રની પરંપરામાં બીજું પણ એક તત્ત્વ છે. જે લોકોમાં રાજ્યશકૃતિને પડકાર આપવાની તેજસ્વિતા ન હોય એવો લોકો જ્યારે રાજકારભારથી કંટાળતા, ત્યારે રાજાની ધરૂમબુદ્ધિ જાગૃત કરવા માટે તથા પોતાની નિરાશા પ્રગટ કરવા માટે અનેક જાતનાં કશ્યો સહન કરતા. અનુપવાસ કરવા, પોતાનું જ નુકસાન કરવું, આત્મહત્યા કરવી વગેરે પ્રકારો તેઓ અજમાવતા. એને ત્રાગું કહે છે.

સૌરાશ્ટ્ર-સંસ્કૃતિનાં આ બંને તત્ત્વોને શુદ્ધ કરી, ગાંધીજીએ એને આધ્યાત્મિક રૂપ આપ્યું.

ગાંધીજીનું વ્યક્તિત્વ ઘડનારાં બીજાં બે તત્ત્વો તે વૈશણવ અને જૈન સંસ્કૃતિ. વૈશણવ હંમેશાં સદાચારનો આગરહ રાખનારો ભક્ત હોય છે. પોતાનો બધો આર્થિક, સામાજિક વહેવાર સદાચારની મર્યાદામાં રહીને જ કરવાનું એમનું બિરદ. ‘વૈશણવ જન તો તેને કહીએ’ એ ભજનમાં વૈશણવોનાં જે લક્ષણો કહ્યાં છે, તદનુસાર જીવવાનો બાપુજી અખંડ પ્રયત્ન કરતા હતા.

આવી જ જાતનો એક અસાધારણ પ્રભાવ એમના મન પર પડ્યો તે જૈન સાધુઓના વિરકૃત અને તપસ્વી જીવનનો. વૈશણવોની મર્યાદા, જૈનોનાં તપ અને અહિસા, આ તત્ત્વોને બાપુજીએ સ્વીકાર કર્યો. એટલું જ નહિ, પોતાની બુદ્ધિ અનુસાર આ તત્ત્વોને એમણે શુદ્ધ પણ કર્યાં.

વિલાયતમાં ખરિસ્તી ધરૂમપરસારકો સાથે એમની ઓળખાણ થચી. ખરિસ્તી ધરૂમના અુત્તમોત્તમ રંધો એમણે વાંચ્યા. ખરિસ્તના જીવનની અને અુપદેશની એમના ચિત્ત પર ઘણી અસર થચી. ખરિસ્તી ધરૂમસાધનાના ગુણદોશ ધ્યાનમાં આવ્યા પછી ગાંધીજી આરૂધ્યપરંપરાની સાધનાના ગુણદોશ પણ ઓળખી શક્યા.

એમને ભારતમાં અંગરેજોનો એક જાતનો અનુભવ હતો. વિલાયતમાં બીજી જાતનો અનુભવ મળ્યો. અને દક્ષિણ આફ્રિકામાં એમને યુરોપીય સંસ્કૃતિનું ત્રીજું દર્શન થયું. ગાંધીજીના ઘડતરમાં દક્ષિણ આફ્રિકાના અનુભવનો ફાળો સહૃથી મોટો હતો. રેસ્ક્ઝિન, ટોલ્સ્ટોય વગેરેનાં પુસ્તકો ત્યાં એમને વાંચવા મળ્યાં, અને આત્મપરધાન ભારતીય સંસ્કૃતિ તથા ભોગપરધાન આધુનિક સંસ્કૃતિના ગુણઅવગુણ અને બલાબલ તેઓ જોઓ શક્યા. આ બને સંસ્કૃતિ વચ્ચેનો સાત્ત્વિક સંઘર્ષ યુગપુરુશની શરૂઆથી એમણે પોતાના સત્યાંગ દ્વારા શરૂ કર્યો.

*

“કોને મદદ કરીએ ?”

એશિયામાં ફેલાયેલા ભૂખમરાની વિકરાળતા જાણી અમેરિકાના કેટલાક મોટા લોકો, “આપણો કચી રીતે મદદ કરી શકીએ” એ જાતે જોવા આવ્યા હતા. એમનું શિશ્ટમંડળ ગાંધીજીને દિલ્હી ખાતે ભંગીવાસમાં [એમને અુતારે] મળ્યું. ઘણા સવાલ-જવાબ થયા. એક જ્યે ગાંધીજીને સીધો સવાલ પૂછ્યો કે, “હિંદુસ્તાનની ભીડ ભારે છે, જાપાનની પણ છે; બનેને મદદ ન પહોંચાડી શકીએ, તો અમારે કોને મદદ કરવી ?”

હિંદુસ્તાનમાં ભૂખમરાથી લાખો લોકો ટળવળતા હતા. પણ ધરૂમમૂરૂતિ ગાંધીજીને અમેરિકાના પ્રતિનિધિએ “અમારો ધરૂમ શો ?” એ સવાલ પૂછ્યો હતો. ગાંધીજી એક કુશાણ થોભ્યા, અને એમણે ગંભીર સ્વરે જવાબ વાય્યો : “મારા મનમાં લવલેશ શંકા નથી કે તમારે જાપાનને જ મદદ કરવી.” અને તરત કારણ પણ કહી દીધું : “તમે હિંદુસ્તાનને મદદ કરશો તો તે સેવાભાવથી પેરાઓને, અનુપકારવૃત્તિથી. પણ તમારે જાપાનની સેવા કરવી છે પ્રાયશચિત્તવૃત્તિથી. તમે લોકોએ જાપાનનો નાશ કર્યો છે, એક બાહોશ વીરરાશ્ટ્રના આત્માને હણ્યો છે. એ પાપ ધોઓ કાઢવું, એ તમારી પ્રથમ ફરજ છે. એ દિશામાં યત્કિંચિત પણ કરી શકશો, તો તમારી માણસાઓ બચવા પામશે.”

*

જનતા પરની શરદ્ધા

રોમે રોલાંએ ગાંધીજીને “પોલિસાયકોલોજિસ્ટ” કહ્યા છે. પોલિસાયકોલોજિસ્ટ એટલે જુદા જુદા પ્રકારના લોકોની અને સમાજની મનોરચના સમજનારો પુરુશ. એમની સત્યનિશ્ઠા, એમની અહિંસા-ભક્તિ અને એમની અવરૂષાનીય આસ્તિકતા—આ તરફ અદ્ભુત શક્તિઓને લીધે એમનું મન કોઓં પણ નવી ભૂમિકા સમજી લેવા તૈયાર રહેતું. જેટલી સહેલાઓથી તેઓ અશિક્ષિત લોકોને પોતાની વાત સમજાવી શકતા, તેટલી જે સહેલાઓથી પ્રખર બુદ્ધિવાદી લોકો સાથે પણ તેઓ ચર્ચા કરી શકતા. ચર્ચામાં એમણે કદી, કોઓંની આગળ હાર ખાંધી નથી. પણ પોતાની બૌદ્ધિક તેજસ્વિતાની ચમક બતાવવાનો પ્રયત્ન પણ એમણે કદી કર્યો નથી. નમ્રતા જ તેમનું કવચ હતું.

કોઓંની પણ સાથે વાત કરવા માંડે, એટલે એમની આંખોમાંથી સહાનુભૂતિ વહેવા લાગે અને સામા માણસનું દૂરુશ્ટિબિંદુ તરત જ એમના ધ્યાનમાં આવી જાય. એની શક્તિ-અશક્તિ બધું ધ્યાનમાં લાયી તેઓ અને એવી સલાહ આપે કે એ પુરુશાર્થ કરવા તૈયાર થાયી જાય.

એમના સ્વભાવના આ પાસાનું નિરીક્ષણ કર્યા પછી મેં કહેલું કે અમારી પોતાની શક્તિ પર જેટલો અમારો વિશ્વાસ હતો, તેના કરતાં વધારે ગાંધીજીનો હતો. કોક વાર અમારો પોતા પરનો અવિશ્વાસ જોઓ તેઓ કહેતા કે, આ કામ તમે કરી શકશો, હું તમને કહું છું કે કરી શકશો. અભ્યાસ તૈયબજી કહેતા કે, ગાંધીજીએ અમારી પાસે જે કામો કરાવ્યા છે, તે અમે અમારા પોતાના વિશ્વાસે કદી કરી શક્યા ન હોત.

એક વાર ગાંધીજીએ એક અતિશાય કદાચ કામ મને સોંઘ્યું, મેં કહ્યું, “બાપુજી, આટલું અધરું કામ મારાથી થવાનું નથી.” બાપુજી મારી તરફ જોઓને બોલ્યા, “હું તમને કોઓં કાળે સહેલું કામ આપું જ નહીં.” મારે માટે આ વાક્ય પૂરતું હતું. બાપુજી આટલી કદર કરે છે, ત્યારે આપણે એ કામ કરવું જ જોઓએ—એ ભાવના સાથે મેં એ કામ હાથમાં લીધું અને સઝળ કરી બતાવ્યું.

ભારતીય જનતા પર ગાંધીજીની શરદ્ધા હતી. એની શક્તિ-અશક્તિ બંનેની એમને પૂરી ખબર હતી. પોતાના પર જનતાનો જેટલો વિશ્વાસ હતો, તેથી વધારે વિશ્વાસ ગાંધીજીનો એના પર હતો. તેથી જ તેઓ લોકોમાં પ્રાણ ફૂકી શક્યા, એમનો અત્મવિશ્વાસ વધારી શક્યા, અને એમની પાસેથી લોકોત્તર કામો કરાવી શક્યા.

હજારો વર્ષશાની ભારતીય સંસ્કૃતિના અને ભારતીય પુરુશાર્થના તેઓ પ્રતિનિધિ

હતા. તેથી લોકો તેમની પાછળ જરૂરી શક્કયા. એમના અજુજ્જવળ ચારિત્ર્યને લીધે, સંકટભરેલો માર્ગ હોવા છતાં લોકોને એમની પાછળ જવામાં બીક અથવા સંકોચ થયો નહિ.

*

હિંદી સંસ્કૃતિના સર્વોચ્ચ આદર્શોને અનુસરીને ગાંધીજીએ પોતાનું ધ્યેય ઘડ્યું છે. પણ લોકોને તે પોતાનું છતાંય દૂર દૂરનું લાગે છે. લોકોને આજે ગળે ખૂટરે તેવું સ્વરાજનું ધ્યેય સન્મુખ રાખીને ગાંધીજી કામ કરે છે. સાથે સાથે પોતાને શૈરેશ લાગતું ધ્યેય પણ તેઓ લોકો આગળ સતત જાગતું રાખે છે. ગાંધીજીના આ આદર્શનાનું લોકમાન્ય ટિપ્પેકે મજાનું વર્ષણન કર્યું છે : દરિયામાં ફરતું વહાણ ધૂવના તારા પર લક્ષ્ણ રાખીને ચાલે છે, પણ તે કાંઈ ધૂવતારા અપર નથી જતું. કોઝી ને કોઝી દુન્યવી બંદર જ તેનું ધ્યેય હોય છે. તે જ પ્રમાણે વ્યવહારની અપેક્ષા કરી કેવળ ધર્મનો જ વિચાર રાખીને નફકી કરેલું ધ્યેય અધૂરું હોય છે. ધૂવતારા તરફ ધ્યાન તો રાખો જ, તેના વગર ચાલશે નહિ; પણ જહાજને ધૂવ અપર લખી જવાનું નથી.

*

આ દેશમાં નવો એવો એક પણ દોશ નથી. બધા જ દોશો પહેલેથી ચાલતા આવેલા છે. જ્યારે પુરુષાર્થ ક્રશીણ થાય છે, અનુદર વ્યાપકતાનો અસ્ત થાય છે, ત્યારે સંકુચિત માનસવાળા લોકો આગળ આવે છે. ગાંધીજીએ બતાવી આપ્યું કે નેત્રુત્વ જો સાંદું હોય તો આ જ જનતા જાગરત અને કર્સ્તવ્યપરાયણ થખી શકે છે.

*

બ્રાહ્મણોની અનાસંક્રિતિ, ક્ષાત્રિયોની વીરવૃત્તિ, વૈશ્યોની દીર્ઘદર્શિતા અને શૂદ્ધરોની સેવાપરાયણતાનું જ્યારે અશ્વરનિશ્ઠા સાથે એક રસાયણ બની જાય છે, ત્યારે જ સમાજની અન્નતિ થખી શકે છે. ગાંધીજીએ દુનિયા સામે આ આદર્શ જીવી બતાવ્યો.

ગાંધીજીએ અસાધારણ અજુજ્જવળ આદર્શ સમાજ આગળ મુક્ક્યો, તેમાં એમનું મહત્ત્વ નથી; પણ એ અસ્ય આદર્શ પ્રમાણે તેઓ પોતે જીવી બતાવે છે અને એ આદર્શ પર્યે લોકોની શરદ્ધા જગાડી રાશ્ટ્રરના અસંખ્ય લોકોને નવજીવન અરૂપે છે, એટલે તેઓ મહાત્મા ગણાય છે.

*

પાપીનો પણ પ્રતિનિધિ

ગાંધીજીનું સત્યાગ્રહનું એક વ્યાકરણ હતું. આ વ્યાકરણનો નિયમ ન પાળતાં જે સત્યાગ્રહ કરવામાં આવે છે તે દુરાગરહ બને છે, જબરદસ્તીનો એક પ્રકાર બને છે. છેલ્લાં વીસ વરસોમાં [1950 પદ્ધીનાં] કોઅઓએ પણ શુદ્ધ સત્યાગ્રહના દાખલા લોકો આગળ મૂક્યા નથી. પરિણામે સત્યાગ્રહની જગ્યા હત્યાગ્રહે લીધી છે. હત્યાગ્રહ કાં તો કાયદેસર સરકારને ખાઝી જશે, અથવા સર્વત્ર ગુંડાનું રાજ્ય શરૂ કરશે.

જ્યારે ચૌરીચૌરા હત્યાકાંડ થયો, ત્યારે ગાંધીજી એને રાશ્ટ્રરીય પાપ માન્યું અને પોતે પ્રાયશચિત્તરૂપે અપવાસ કર્યા. ત્યારે કેટલાક લોકો ગાંધીજી પાસે જાઓ કહેવા લાગ્યા કે, “આપ અહિંસાના પૂજારી છો એ આખી દુનિયા જાણો છો. ત્યાં જે લોકોએ હિંસા કરી, તેમની સાથે આપનો દૂરનો પણ સંબંધ જોડવાની હિંમત કોઅિ કરવાનું નથી. પદી આપ એ પાપ માટે પોતાને જવાબદાર શા માટે માનો છો ?”

ગાંધીજીએ જવાબ આપ્યો : “હું પોતાને મનથી ભારતનો પ્રતિનિધિ માન્યું છું. આખાય ભારતનો હું સેવક પ્રતિનિધિ છું. ભારતના પુષ્યવાન તેમ જ પાપી, બધાનો હું પ્રતિનિધિ છું. આ દેશની કોઅિ પણ બ્યક્ફુટએ આ રીતે હિંસા કરી, તો તેની જવાબદારી મારે માથે આવી પડે છે. સમગ્ર ભારત વતી હું પણ જવાબદાર ન કરું, તો મારું પ્રતિનિધિત્વ લજવાશે.”

તેથી જ રાશ્ટ્રરે એમને રાશ્ટ્રપિતા કહ્યા.

*

ગાંધીજીનું શૌર્ય બરિટિશ સલ્તનત જેવી જગ્ગાવ્યાપી સલ્તનત સામે લડવામાં નથી, પણ અંતરાત્માના અવાજ સામે અસંખ્ય લોકો પોકાર કરે તોપણ તે પોકારને કાન ન ઢેવાની હિંમત ધરાવવામાં છે. તેઓ નથી રાજ્ઞિનિશ્ઠ કે નથી રાશ્ટ્રરનિશ્ઠ, નથી શાસ્ત્રરનિશ્ઠ કે નથી સમાજનિશ્ઠ. તેઓ તો આત્મનિશ્ઠ છે.

“આવું ઘણું સાચવવું પડે છે.....”

બાપુજીએ જ્યારે ગુજરાત વિદ્યાપીઠની પુનરૂરચના કરી [તેનો] ભાર મને સોંખ્યો ત્યારની વાત છે.

ખાદી માટેનો આગરહ દેશ આગળ જાહેર કર્યા છતાં ઘરની જ વિદ્યાપીઠમાં ખાદીનો એવો સ્વીકાર થયેલો ન હતો. વિદ્યાર્થીઓ ખાદી પહેરતા કેમકે એ વિદ્યાપીઠનો ગણવેશ હતો એટલું જ. ખાદીભક્તિ કેવળ કડક નિયમો કરવાથી અને એ નિયમોની આર ભોકવાથી અનુત્પન્ન થવાની નથી, એ હું જાણતો હતો. મારી બધી શકૃતિ મારાં પ્રાર્થના-પ્રવચનોમાં હું રેડી શકતો હતો. પરિણામે વિદ્યાર્થીઓ રેંટિયા ચલાવવા તૈયાર થયા. પૂણીઓ માટે પીંઝણકળા પણ શીખવા લાગ્યા.

[અગાઅનુ] માંદો પડીને જ્યારે હું પૂના પાસેની રાશ્ટ્રીય શાળામાં જરૂરીને રહ્યો હતો, ત્યારે ત્યાંથી બે-ત્રણ વિદ્યાર્થીઓને ખાદીનું મહત્ત્વ સમજાવી સાબરમતી આશ્રમમાં મોકલ્યા હતા. [આશ્રમમાં] એ છોકરાઓ પાછળ મેં ઠીક ઠીક મહેનત લીધી હતી. એટલે [પછી] એ લોકોને જ વિદ્યાપીઠમાં કાંતણ-પીંઝણ શીખવવા લખી લીધા. એમાંથી એક પ્રકરણ ઔબું થયું.

થોડા હિવસમાં વિદ્યાપીઠના વિદ્યાર્થીઓમાં મહારાશ્ટ્રી-ગુજરાતીની ચર્ચા શરૂ થયી. “કાકા મહારાશ્ટ્રી છે, એટલે એમણે મહારાશ્ટ્રીઓ વિદ્યાપીઠમાં આવ્યા છે,” એ જાતના અદ્ભુતારો મારા કાને આવ્યા. એ વિદ્યાર્થીઓ મહારાશ્ટ્રી છે એનું ભાન પણ મને ન હતું. મારી કલ્યાણ પ્રમાણે એ કળામાં પ્રવીષ થયા છે અને બરાબર શીખવી શકશે, એટલું જોઓને મેં એમને વિદ્યાપીઠમાં લીધા હતા. એટલે મારા આશ્ચર્યનો પાર ન રહ્યો. જે વસ્તુ મારે વિશે ગુજરાતના મનમાં કોઓ કાળે ઔગી ન હતી, તે સાંભળીને હું હેબતાઓ જ ગયો.

એ વાત મેં બાપુજીને કાને નાખી. તેમણે કહ્યું, “તમારે વિશે ગુજરાતમાં કે બીજે ક્રયાંય કોઓનાં મનમાં શંકા આડું જ નહિ. પણ તમે જે મહારાશ્ટ્રીઓને ત્યાં લખી ગયા, એમના સ્વત્બાવનો વિચાર કરવો જોઓિતો હતો. તમારી આસપાસ મહારાશ્ટ્રીઓને બેગા ન કરવા, એ જ આ દેશને માટે સુરક્ષિત નીતિ ગણાય. તમારામાં પ્રાંતીયતા નથી, તેટલા પરથી આખા દેશનો એ હોશ દૂર થયો છે એમ તો ન જ મનાય.”

આટલું કહીને એક સરસ દાખલો બાપુજીને યાદ આવ્યો તે એમણે મને કહ્યો : “તમે જાણો છો. [કે] મુંબાસીનું દૈનિક ‘બોમ્બે ફ્રોન્ટિલ’ કોંગ્રેસનું ધાપું ગણાય. એના

મુખ્ય એડિટર મિ. બ્રેલ્વી એ અંગરેજી ફૈનિક સરસ ચલાવે છે. એણે પોતાની આસપાસ એક પણ મુસલમાનને રાખ્યો નથી. આપણા દેશમાં આવું ઘણું સાચવવું પડે છે.”

બાપુજીની શિખામણ પૂરી ગળે ઝૂતારી. આટલી સાવચેતી બાપુજીએ મને શીખવવી પડી, એની લજ્જાથી હું પાણી પાણી થાયી ગયો. મેં તરત જ જરૂરી પગલાં ભર્યાં. મારે માટે જિંદગીનો એ એક કીમતી અનુભવ થયો.

*

સનાતની છતાં સુધારક

બાપુજી જ્યારે દફુશિષણ આફરિકાથી ભારત આવ્યા ત્યારે એમને માથે ચોટલી ન હતી, ગળામાં જનોઓ ન હતી. હરદ્વારના કુંભ મેળામાં એક સાધુએ તેઓને બંને માટે આગરહ કર્યો. ત્યારે બાપુજીએ માથે ચોટલી રાખવાનું સ્વીકાર્યું, અને જનોઓની ના પાડી. એની વાત મારી આગળ કરતાં કહ્યું :

“મારે હિંદુ સમાજમાં મોટા મોટા સુધારા કરવા છે, સુધારા માટે લડવું છે, અને તે પણ એક નિશઠાવાન હિંદુ તરીકે. ભરસંગ આવ્યે મારે આ સમાજ વિરુદ્ધ અધ્યવાસ પણ કરવા પડે. તેથી મારે સમાજ સાથે શક્ય તેટલા એકરૂપ થવું છે. હું પોતાનો જ છું, એવું આ સમાજને લાગવું જોઈએ. તો જ હું એમાં કાંઈ ફેરફાર કરાવી શકીશ. ત્યારે જેટલી બાબતમાં એમના રિવાજો પળાય, તેટલામાં એમને રાજી રાખવા એ જ અસ્તમ નીતિ છે. માથે ચોટલી રાખવા જેવી નજીવી વસ્તુમાં સુધારો કરી સમાજથી નોખા પડવામાં લાભ શો ??”

જનોઓ વિશે એમણે કહ્યું : “હિંદુ સમાજમાં નકામા અનેક વાડા પડ્યા છે, અને તેથી હિંદુ સમાજ નબળો પડતો જાય છે. તેના કકડા થાય છે એમાં અમુક લોકોને જનોઓનો અધિકાર છે, અમુકને નથી, એવો નકામો બેદ છે. ત્યારે આપણે એ અધિકાર વિનાના લોકોમાં જ ભળી જાઓ.”

ગાંધીજીમાં બહુ મોટો સુધારક હતો. પણ ગાંધીજી વાણિયા હતા. આ સ્વભાવને લીધે ગાંધીજીએ પોતાનો સમાવેશ સનાતનીઓમાં કરાવ્યો, અને કાર્યક્રમ સ્વીકાર્યો સુધારકોનો.

*

સત્તુશિશ્ય મેળવવાનું સદ્ગ્રાહ્ય

આપણા દેશમાં રાજહ્રવારી નેતાપણું મોટે ભાગે કાયદા-પંડિતોને જ વરતું આવ્યું છે. પણ પિતામહ દાદાભાઈ, સુરેન્દ્રનાથ બેનરજી, અરવિંદ ઘોશ, ગોખલેજી, એ બધા કેળવણીના ફ્રોટરમાં અનુભવ લીધા પછી જ રાજહ્રવારી ફ્રોટરમાં પડેલા છે.

ગોખલેજીએ ગણિત, ઐતિહાસ તેમ જ રાજકારણના અધ્યાપક તરીકે નામના મેળવી; પણ એમનું મુખ્ય જીવનકાર્ય કેળવણીની ચાર દીવાલ બહાર થયું છે.

ગોખલેના અનેક શિશ્યો થયા છે. છતાં “શિશ્યાત્ અિચ્છેત્ પરાજ્યમ્” અથવા “શિશ્યે અિચ્છેત્ પુનર્ભવમ્” એ સૂત્રોનો જો કાંઈ અરૂથ હોય, તો ગોખલેના એકમાત્ર શિશ્ય તે ગાંધીજી છે.

ન્યાયમૂરૂતિ રાનદેના શિશ્ય ગોખલે, અને ગોખલેના શિશ્ય ગાંધી, એવી શિશ્યપરંપરા મનાય છે. રાનદેએ ઘણા લોકો આપર અસર પાડી. તેમાંથી ગોખલેનું તો આખું રાજકીય ઘડતર રાનદેને હાથે થયું હતું. પણ તેવી જ રીતે ગાંધીજીનું ઘડતર ગોખલેજીને હાથે થયું હતું એમ ન કહેવાય. ગાંધીજીનું ઘડતર એમનું પોતાનું જ છે.

ગોખલેએ નક્કી કર્યું કે દેશના રાજકારણમાં આધ્યાત્મિક કુત્તિ ભરી દેવી. ગાંધીજી આ પાઠ ગોખલે પાસેથી શીખ્યા નથી. પણ પોતાના જીવનમાં ખીલવેલો આ સિદ્ધધાંત ગોખલેજીને પણ પસંદ છે, તેઓ પણ પોતાના અનુભવને અંતે એ જ નિરૂષય પર આવ્યા છે, એમ જોઈ ગાંધીજીએ પોતાની નિશ્ઠા ગોખલેજી પ્રત્યે વાળી.

દરેક જુવાનના હુરુદ્યને શિરછત્ર રૂપ કોઝી ને કોઝી મુરબ્બીની જરૂર હોય છે. ઘર છોડીને ગાંધીજી વિલાયત ગયા, એટેટે ત્યાં એમણે પિતામહ દાદાભાઈને એ સ્થાને સ્થાપ્યા. હિંદના રાજકીય જીવનમાં પરેશ કરવા માટે પણ એમને કોઝી મુરબ્બીની જરૂર હતી. એમના યુવાન હુરુદ્યને જે જાતની ભૂખ હતી, તે ત્યુપ્ત કરનારા એમને ગોખલે જ મળ્યા.

ગોખલેની કાર્યપદ્ધતિ જુદી, અને ગાંધીજીની જુદી; છતાં બંને વચ્ચે સુંદર સંબંધ બંધાયો. તેનું એક કારણ બંનેમાં રહેલો આધ્યાત્મિકતા છે. જે કામ કરવું હોય તેનો પૂરતો અભ્યાસ કરવો, જીણામાં જીણી વિગતો સમજી લેવી, પ્રતિપક્ષી પ્રત્યે પૂરતી અનુદારતા કેળવવી, પરિણામ વિશે અધીરાન થવું, અને દેશવાસીઓ કે પરદેશીઓ જેવા છે તેવા લખીને એમના પ્રત્યે અસંતોશ કે અકળામણ બતાવ્યા વગર કામ કર્યે જવું, એવી કુત્તિ બંનેમાં સમાન હતી. રમતમાં ખરાબ પાનાં પોતાના હાથમાં આવ્યાં એવી ફરિયાદ ન કરતાં, સારો રમનાર જેવાં

પાનાં મળ્યાં તેવાંનો સારામાં સારો અધ્યયોગ કરી પોતાની શકૃતિનો પરિચય કરાવે છે. વૈદ્ય અને વકીલ પોતાના હાથમાં આવેલો ડેસ અટપટો કે ગુંચવણભરેલો છે એટલા ખાતર અકળાતો નથી, પણ વિશિષ્ટ પરિસ્થિતિમાં જે થાઈ શકે તેમ હોય તે બધું કરી છૂટે છે. તેવી રીતે આ બંને દેશસેવકો પણ એ જનિશકામ, અનાસકૃત ભાવે સેવા કરવામાં માનવાવાળા હોવાથી બંને વર્ચ્યે સ્નેહરંધ્રિ બંધાયી.

અને બંનેનું કાર્ય જોતાં એમ જ કહેવું પડે કે ગાંધીજીએ પોતાના જીવનમાં ગોખલેજીની સુધારેલી વધારેલી અને એ રીતે તદ્દફન નવી બનેલી આવૃત્તિ કાઢી. પોતાના રાજકુલ્યારી દિશાદરૂશક ગોખલેજીએ જે જે કામો હાથ ધર્યાં તે બધાંને દિવ્ય ઓપ આપીને ગાંધીજીએ અચ્યુત ભૂમિકા અધ્યપર ચડાવ્યાં.

આનું નામ તે સત્યશિશ્ય મેળવવાનું સદ્ગુરૂભાગ્ય.

*

કુશળ માળી

એક વાર ગાંધીજીને મેં ઘરન પૂછ્યો : “આપ અમ સહસાધકોના સાથી જ નહિ, મારુગદરૂશક પણ છો. અમારા દોશ આપ સહન કેમ કરો છો ? અમને તે બતાવતા કેમ નથી ?”

ત્યારે એમણે કહ્યું કે, “હું એક કુશળ માળી છું. માળી શું કરે છે ? એ એક છોડ વાવે એટલે એને ખાતરપાણી આપે. હવે, એ છોડની આસપાસ ઘાસ પણ આગે છે. એ ઘાસને પણ પેલું ખાતરપાણી મળે છે. છોડની દૂરુષટિએ ઘાસ અનિશ્ચત છે. છતાંય માળી એને તરત અનુભેડી નથી નાખતો. એને ખબર હોય છે કે, ઘાસ આગેડવા જરૂરી તો પેલો છોડ પણ કદાચ આગડી જશે. તેથી એ ધીરજ રાખે છે. પછી કાળાંતરે જ્યારે એને ખાતરી થાય છે કે હવે છોડનાં મૂળિયાં મજબૂત થયાં છે, ત્યારે જ એ કુશળતાપૂર્વક પેલું ઘાસ આનુભેડી નામે છે.”

ગાંધીજીની આ વાત સાંભળીને તે જ કુશળથી હું પોતાના આચારવિચારમાં ગાંધીજીને ન ગમતા કયા કયા દોશો છે તે શોધવાના ઘયનો કરવા લાગ્યો. દોશો શોધવા અધરા ન હતા. પરંતુ નજરે ચેઠલા દોશોને ફેંકી દેવા એ કેટલું અઘરું છે, એની તે દિવસથી મને ખબર પડવા લાગ્યી.

ગાંધીજીનો એકમાત્ર શિશ્ય

એક વાર મારે બાપુજી સાથે સાખરમતી સ્ટેશને જવાનું હતું. ગાંધીજીએ ટાંગો મંગાયો. એમની સાથે એક ભારતીય મહિલા હતી. ટાંગો ચાલવા લાગ્યો. પેલાં બહેન સાથે બાપુજીની વાતો ચાલતી હતી.

અચાનક બાપુજીની દૂરુશટિ પેલી બહેનના હાથ પર પડી. એના નખ વધ્યા હતા. ગાંધીજીએ એને કહ્યું, “આવી રીતે નખ વધારવા એ સારું નથી, એ મેં તને કેટલી વાર કહ્યું છે ? તો પણ તું ધ્યાન નથી આપતી.” એણે માત્ર “અંહ” કર્યું. ગાંધીજીએ તરત પોતાની થેલીમાંથી ચાપુ કાઢ્યો અને એનો હાથ પકડી બધા નખ કાપી નાખ્યા.

ગાંધીજીનો સ્વભાવ શિકુશકનો. એક-બે વાર કહી જોશે. ત્રીજી વાર પોતે કરી બતાવશે. પણ બાપુજીનું આ વરૂતન મને કાંચી ગમ્યું નહિ. એક બેદરકાર બહેનની આટલી સેવા કે ખુશામત ગાંધીજી કરે, એમાં મને ઔચિત્યનો ભંગ દેખાયો. તે ફ્રશણે હું કશું બોલ્યો નહિ. પણ પછી થયું કે મનમાં જે આવ્યું તે બાપુજીથી છુપાવવું સારું નહિ. તેથી એકાંત મળતાં જ મેં બાપુજીને કહ્યું :

“મને માફ કરો. મનમાં આવ્યું તે આપની આગળ મૂકું દ્યું. આપને ખબર જ છે કે એમે જે આપની પાસે આવીને રહ્યાં છીએ તે બધાં આપની તરફ ગુરુભાવે જોઓએ છીએ. આપના વિચારોની જેમ અમારા જીવન પર અસર થતી હોય છે, તેમ આપની વરૂતણૂકની પણ ઝૂંડી અસર થાય છે. આજે આપે પેલાં બહેનનો હાથ પકડી એના નખ કાયા, તે મને ગમ્યું નહિ. તરુણોને એમ કરવાની બિચારા થાય, તો તેમને માટે આ અદ્વાહરણ પોતાનું સમરૂથન કરવા માટે પૂરતું થશો.”

બાપુજીએ કહ્યું કે, “એને મેં બજ્જે વાર કહ્યું છતાં એણે ધ્યાન ન આપ્યું; એને સમજાવવાનો આ જ એક રસ્તો બાકી હતો.” વાત ત્યાં પૂરી થયી.

પછી અમે બધાં આશરમવાસી પ્રારૂથના માટે ભેગાં થયાં ત્યારે પ્રારૂથના પછીના પ્રવચનમાં બાપુજીએ કહ્યું : “આજે કાકાસાહેબે એક મિત્રકાર્ય કર્યું...”

વાક્ય કાન પર પડતાં છાતીમાં “ધડક ધડક” થયું. મનમાં થયું : હવે બધું જ કહી દેશે કે શું ? મારાથી રહેવાયું નહીં તેથી એકાંતમાં મેં જે કહ્યું, તે આવી રીતે બહાર કેમ આવે ? ગાંધીજીએ કેમ વરૂતવું એ તેમને કહેવાનો મને શો અધિકાર છે ?પણ હવે શું થાય ?

પણ બાપુજીએ આખી વાત કહી નહીં. એમણે એટલું જ કહ્યું કે, “કાકાસાહેબનું

કહેવું છે કે તેઓ અને તેમના જેવા અનેક લોકો મારી તરફ ગુરુભાવનાથી જુએ છે. [તો] હું આજે બધાંને કહેવા માગું છું કે હું કોઝીનો ગુરુ નથી, થવા અભિષ્ઠતો નથી, થાં શકતો પણ નથી. દૃક્ષિણ આફ્રિકામાં એક ભાસીએ મારા શિશ્ય થવાની અભિષ્ટ પરદર્શિત કરી. મેં એમનું કહેવું માન્ય કર્યું. તે વખતે મારામાં એટલું અભિમાન હતું. પણ તેની જવાબદારી લીધા પછી મારે ઠીકઠીક પસ્તાવું પડ્યું. મને ખાતરી થાં ગાંધી કે ગુરુ બનીને બીજાને રસ્તો બતાવવો સહેલો નથી. આજે મારો એક જ શિશ્ય છે— તે હું પોતે. એ એકને સાચવતાં સાચવતાં મને કેટલો ત્રાસ થાય છે, તે હું જ જાણું અને અશીવર જાણે. મેં આશરમ શરૂ કર્યો છે અને તમને બધાંને આમંત્રણ આપ્યું છે; તેથી તમે મને પોતાનો ભાસી માની શકો છો, પણ હું કોઝીનો ગુરુ નથી.”

*

અદ્ભુત રસાયણ

શક લોકો સામે જૂઝીને દેશને સ્વતંત્ર કરનાર શાલિવાહન રાજા વિશે દંતકથા કહે છે કે એ રાજા પાસે એવું અદ્ભુત રસાયણ હતું કે એ પોતાના કુંભારને ત્યાં જાણી, માટીના સિપાહીઓ બનાવી એ રસાયણથી એમને જીવતા કરી લડાયીમાં વાપરતો.

ગાંધીજી પાસે આપણે એવું એક રસાયણ અવશ્ય જોખીએ છીએ કે જેથી તેઓ માટીના માણસમાંથી તેજસ્વી આત્મપરાયણ સિપાહીઓ તૈયાર કરી શક્યા છે. તેથી દરેક કેળવણીકારને ગાંધીજીના આ કીમિયાનું રહસ્ય શું છે એ શોધી કાઢ્યા વિના છૂટકો નથી.

ચાર દીવાલ વર્ચ્યે બાળકોને લાચી બેસી એમનામાં ઓછીવતી માહિતી રેડવી અથવા એમને ભાશાપર્વીણ બનાવવાં, એ કાંચી સાચી કેળવણી નથી. પણ આબાલવૃદ્ધ સ્ત્રીપુરુષોને જીવન મારફત કેળવી એમનામાં રહેલો સુખ દેવી અંશ જાગ્રત કરવો, તેમને પોતાના અમૃતવારસાનું ભાન કરાવવું, અને માણસની કલ્યનામાં પણ ન આવી શકે એવી સજ્જનતા, એવું પરાક્રમ અને એવી શાંતિ એમના જીવનમાં ખીલવી બતાવવી, એનું નામ તે ખરી કેળવણી.

એવા કેળવણીકારો દુનિયામાં ભાગ્યે જ દસ-વીસથી વધારે પાક્યા હોય. એ સહુમાં પણ ગાંધીજીની વિભૂતિ વિશેશપણે તરી આવે છે. કરોડો લોકોવાળા આખા રાશ્ટ્રરને હાથમાં લાચી, એના અન્તિહાસિક વજ્રલેપ દુર્ગુણો જાણતા અને અનુભવતા છીતાં એ રજા અપર વિશ્વાસ રાખી, પોતાના જ જીવનકાળમાં એમણે જે એક મોટો વ્યાપક અખતરો કરી બતાવ્યો છે, એનો જોટો વિશ્વ-અન્તિહાસમાં મળતો નથી.

“ભૂલે એવો નથી !”

1915માં બાપુજી ભારત આવ્યા. એમના ગુરુગોખલેજીના કહેવાથી એક વર્ષશે સુધી એમણે દેશ આખામાં ફરી કેવળ નિરીક્ષણશા કર્યું; ત્યાં સુધી કોઝી જહેર કામમાં ભાગ ન લીધો. એક વર્ષશેને અંતે પ્રથમ [અંગરેજી અઠવાડિક] ‘ધંગ મિન્ડીઆ’ હાથમાં લીધું. [પછી] ગાંધીજીએ ગુજરાતી સાપ્તાહિક ચલાવવાનું નફકી કર્યું. આ વાતની જાણ થતાંવેંત અન્ધુલાલ યાનિક મદદે આવ્યા. ‘નવજીવન અને સત્ય’ કરીને એમનું એક માસિક ચાલતું હતું; માલિકોએ એ ગાંધીજીને સોંપી દીધું. એ જ નામ ટૂંકાવીને બાપુજીએ અને સાપ્તાહિક બનાવ્યું. શંકરલાલ બેંકરે એને માટે એક પેસ ખરીદી લીધો.

ગાંધીજી ભારત આવ્યા તે પહેલાં લોકમાન્ય ટિળકે મુખભીમાં એક મરાઠી દૈનિક ‘રાશ્ટ્રર-મત’ શરૂ કર્યું હતું. એમાં શરી ગંગાધરરાવ દેશપાંડેએ મને ખેંચ્યો. પછી ગુજરાતી ‘રાશ્ટ્રરમત’ શરૂ કરવાનું નફકી થયું. મરાઠીમાંથી ગુજરાતી અનુવાદ કરનાર એક જીવાન એમને મળ્યો, જે ગુજરાતી હોવા છતાં મરાઠીમાં વ્યાખ્યાનો આપતો હતો. એ આપણા સ્વામી આનંદ. ‘રાશ્ટ્રર-મત’માં એની [ને] મારી અનુત્તમ દોસ્તી થયી.

હું આશરમમાં દાખલ થયો, એટલે મારા ઓળખીતા લોકો પણ આશરમમાં મને મળવા આવવા લાગ્યા. તેઓ ગાંધીજીને પણ મળે. આમ આવનારા લોકોમાં સ્વામી આનંદ [હતા]. આટલી નાની અનુમરે પણ સ્વામીએ પોતાની કાર્યશક્તિનો પરિચય આપ્યો હતો. સ્વામીએ બાપુને વચન આપ્યું કે, નવજીવન પેસનું કામ હું છ મહિના સુધી સંભાળીશ અને તેની વ્યવસ્થા ગોઈવી આપીશ. બાપુજીએ સ્વામી આનંદને પેસ અને ધાપાનું કામ સોંપી દીધું. સ્વામીએ નવજીવન પેસનો હવાલો લીધો અને પોતે પેસના સંચાનું એક પૈંડું હોય એટલી લગનીથી તે તેમાં કામ કરવા લાગ્યા.

એક દિવસ મારે પેસમાં જવાનું થયું. ત્યાં જોયું કે સ્વામી પોતાના રિવાજ પ્રમાણે કામ કર્યે જાય છે. દૂધનો ઘાલો પાસે પડેલો છે, સરસ પાકાં કેળાં સામે છે, અને પૂર્ફ એક પછી એક આવતાં જાય છે. સ્વામી ડાબે હાથે કેળું ખાતા જાય અને જમણે હાથે પૂર્ફ સુધારતા જાય. એક પૂર્ફ હાથમાંથી ગયું કે દૂધનો ઘાલો લખી એક ઘૂંટડો ભર્યો, ને પાછા મંડ્યા પૂર્ફ જોવા. ત્રણ-ત્રણ ચાર-ચાર દિવસ સુધી ન નાહતા કે ન શૌચ જતા. જ્યાં કામ, ત્યાં જ સૂવાની પથારી.

આ સથિતિમાં એક દિવસ સ્વામી પર અનુત્તર હિંદના કોઝીક સ્થળેથી બાપુનું પતું આવ્યું. તેમાં કેવળ “તમે ‘નવજીવન’નું કામ સંભાળી લીધું છે, એટલે મને નિરાંત છે; આશા

છે કે તમારું કામ સારું ચાલતું હશે,” એવી મતલબનું લખ્યું હતું. સ્વામી વિમાસણમાં પડ્યા કે, આવો પત્ર કેમ આવ્યો ? મેં કશી મુશકેલીની ફરિયાદ નથી કરી, ને મારે વિશે કોણી એ ફરિયાદ કરી હોય એમ પણ લાગતું નથી. તે બહુ વિચારમાં પડી ગયા.

પણ પછી યાદ આવ્યું કે, ‘નવજીવન’નું કામ મેં છ મહિના માટે માથે લીધેલું, ને તે મુદ્દત આજે પૂરી થાય છે. સ્વામી કહેવા લાગ્યા, “આ વાણિયો ચતુર છે. આજ મારી મુદ્દત પૂરી થઅા, એટલે નવેસરથી બાંધી લેવા માગે છે ! હું ભૂલી ગયો હતો કે હું છ મહિના માટે જ અહીં આવ્યો છું; પણ આ ડોસો ભૂલે એવો નથી. જુઓ, મને ફરીથી કેવો બાંધી લે છે !”

*

માટીના માણસોમાંથી

ગાંધીજીને એમના કીમતીમાં કીમતી પ્રયોગો કરવા માટે સાવ અછના દરજ્જાના સેવકો મળે છે, અને છતાં એમની પ્રેરણા એટલી બધી જલદ છે કે એવાં સાધનોથી પણ તેઓ ચમત્કારી પરિણામ બતાવી શકે છે. આશરમ અને વિદ્યાપીઠ બંને સંસ્થામાં મોટે ભાગે અમે સામાન્ય કોટિના માણસો જ કામ હથમાં લાગી શક્યા, અને છતાં એ પ્રયોગ સફળ નીવડ્યા. જો ગાંધીજીને એમના અખતરા માટે અધ્યરથી નીચે સુધી બધા જ મગનલાલભાઈ ગાંધી જેવા નિશ્ચાવાન લોકો મળ્યા હોત, તો દરેક કામ કેવું દીપી નીકળત એ કોણ કહી શકે ? વખતે ઔશ્વરને એમ સિદ્ધધ કરવું હોય કે સંકલ્પબળ હોય, બુદ્ધિ શુદ્ધધ હોય, તો માટીના માણસોમાંથી પણ સંકલ્પો પાર પાડી શકાય છે. આજે કોણી એમ ન કહી શકે કે ગાંધીજીને અપવાદરૂપ અવૌકિક માણસો મળ્યા તેથી જ તેઓ ફાયા.

*

ગાંધીજી એટલે વિચાર અને આચાર; આચાર માટે વિચાર. જે વિચાર આચારમાં ન પરિણમે, તે તેમને મન કરા અરૂથનો નથી. ગાંધીજીને વિચાર આવ્યો કે આચારમાં પરિણામ્યો જ છે. Live what you believe (તમે જે માનતા હો તે જીવી બતાવો), એ સૂત્રનો વધારેમાં વધારે અમલ કોણી એ કર્યો હોય તો તે ગાંધીજીએ. તેઓ તો એટલે સુધી માને છે કે જેવું માણસનું કર્મ, એવી એની બુદ્ધિ.

*

અડધો કલાક આપવા તૈયાર

હું ગુજરાતીમાં લખતો થયો, તેનું બધું શરેય સ્વામી આનંદને છે. સ્વામી સાથે મારો સંબંધ એટલો નિકટનો કે અમારામાંથી એક જણ જે પ્રકૃતિ આદરે, એ બંનેની ગણાય. ‘નવજીવન’માં મસાલો ખૂટે તો સ્વામી મારી પાસેથી લેખ માગે.

બાપુજીનું તત્ત્વજ્ઞાન વગેરે વિગતો હું જાણું. મરાઠીમાં છાપું ચલાવવાનો મને સારો અનુભવ પણ ખરો. એટલે લેખો આપવામાં મારી અગવડ ફૂક્ત ભાશાની. મારી તૂટીફૂટી ગુજરાતીમાં હું સ્વામીને લેખ લખાવતો જાણું, અને એ પોતે એને માટે સારા સારા શબ્દો પસંદ કરી લેખ લખતા જાય. આમ કેટલાયે સારા તળપદા શબ્દો મારા લેખોમાં આવવા લાગ્યા. લેખોના વિચારો અને નિરૂપણશૈલી મારી, અને ભાશાની કરામત સ્વામીની. વાચકો આશચ્રયચક્રિત થઅી ગયા કે આ કોણ કાકા કાલેલકર એકાએક આભમાંથી ઝૂતરી આવ્યો છે અને આટલું સરસ ગુજરાતી લખે છે !

પછી તો મારું ગુજરાતી લખતાં લખતાં સુધારવાનું કામ બીજાઓ પણ કરવા લાગ્યા. એટલામાં હું તૈયાર પણ થયો. સ્વામી આનંદ પછી જુગતરામ દવે મારા લેખો લખવા લાગ્યા. પછી આવ્યા ચંદ્રરશંકર શુક્રલ.

1930ની આસપાસ જ્યારે બાપુજી ધરવડા જેલમાં “સ્ટેટ પરિઝનર” તરીકે રખાયા હતા, અને જેલના નિયમ પ્રમાણે એમને એક સાથી આપવાની સરકારને જરૂર જણાયી, ત્યારે અન્સપેફ્ટર જનરલ ઓફ પરિઝન્સે મારી પસંદગી કરી મને સાબરમતી જેલમાંથી ધરવડા મોકલ્યો. ત્યાં મારો કાર્યક્રમ ગોઈવવાનો વિચાર હું કરતો હતો, એટલામાં બાપુજી મારી આગળ આવીને કહે : “કાકા, મેં મારા વખતનો ડિસાબ કરી જોયો. હું તમને રોજ અડધો કલાક આપી શકું. મને ખબર છે કે તમને પોતાને હાથ લખવાની ટેવ નથી. સ્વામી, જુગતરામ કે ચંદ્રરશંકરને લખાવો છો. તમારે કાંચી લખાવવું હોય તો હું જરૂર લખી આપું. રોજ અડધો કલાક.”

સાંભળતાંવેંત હું તો પાણી પાણી થઅી ગયો. જ્યારે બોલવા જેવી હાલતમાં આવ્યો ત્યારે મેં કહ્યું, “બાપુજી ! ભગવાને મને વિશેશ બુદ્ધિ આપી નથી, એ ખરું. પણ હું એટલો બધો બાધો નથી કે આપને લખાવવા હું તૈયાર થઅી જાણું.”

ફરી બાપુજીએ કહ્યું, “ના, ના, સંકોચ કરવાનું કશું કારણ નથી. હું, ખરેખર, અડધો કલાક આપવા તૈયાર છું.”

મેં કહ્યું, “આપને હાથે લખાવવા જેવું મારી પાસે કશું છે જ નહીં..”

ખરું જોતાં તે હિવસથી જ મારે પોતાને હાથે લખવાની ટેવ પાડવી જોઓિતી હતી,
જેથી મારું પરાવલંબન મટે.

*

દક્ષિણ આફ્રિકામાં એક વખત એક મુસ્લિમાન બબરચીએ આવીને બાપુને કહ્યું કે,
મને અંગેજી આવડતું હોત તો મને સારા પગારની નોકરી મળત; આજના પગારમાં મારું પૂરું
થતું નથી. એટલે બાપુ તેને અંગેજી શીખવવા તૈયાર થતા. પેલાએ કહ્યું કે, “આપ મને શીખવવા
તૈયાર થયા, એ આપની મહેરબાની; પણ હું નોકરી કરું કે આપની પાસે અંગેજી શીખવા આવું ?”

બાપુએ એનો બિલાજ પણ શોધી. કાઢ્યો—પોતે. રોજ ચાર માઝીલ. પગે. ચાલીને. તેને
ઘેર જાઓ તેને અંગેજી ભણાવવા લાગ્યા.

*

આરો ખેલાડી

કેવા કેવા લોકો સહકારી તરીકે બાપુજીને મળ્યા ! પણ એમણે કદી ફરિયાદ કરી
નહીં. પાનાંનો સારો ખેલાડી જે હોય છે તે લાંબીને રમે છે; હાથમાં ખરાબ પાનાં આવ્યાં,
એવી ફરિયાદ કરતો નથી. એ કહે છે કે, “ગમે તેવાં પાનાં આવે, હું તો એ લાંબીને બરાબર
રમતો રહેવાનો; રમત તોડવાનો નથી.” પોતાના આખા જીવનમાં બાપુજીએ ફરિયાદ કરી
નથી કે, ભગવાને મને આવા સાથીઓ શા માટે આપ્યા, અથવા આવો દેશ કેમ આપ્યો ?
જે કાંઈ ભાગે આવ્યું, તેનો એમણે યોગ્ય અને અનુત્તમ અનુપ્યોગ કર્યો, એવી અદ્ભુત
શક્તિ એમનામાં હતી. આટલા જુદા જુદા પ્રકારના લોકોને સાચવવા, એમની પારો મોટાં
મોટાં કામ કરાવવાં, અને વળી સત્યનો દ્રોહ ક્રયાંય ન થાય તે માટે સાવધ રહેવું, એ કાંઈ
નાનીસૂની સિદ્ધ્યિ નથી.

*

[વિદ્યાપીઠની સ્થાપના વખતે] કેટલાક ધની લોકોએ કહ્યું કે, “અસ્વરૂપતાનિવારણની
વાત પડતી મૂકશો તો અમે તમને તરત અમુક લાખ રૂપિયા આપીશું.” ગાંધીજીએ કહ્યું કે, “લાખ
રૂપિયાની વાત તો જવા દો; કરોડો રૂપિયા આપશો તોયે હરિજનોની અપેક્ષા વિદ્યાપીઠમાં
ન જ થાઓ શકે.”

પોતાનાંને હોમનારા

ગાંધીજી તો માણસોના મોટા શિકારી. પરંતુ ભગવાન જેમ ભક્તની કસોટી કરે, તેમ ગાંધીજી પણ બરોબર કસોટી કર્યા પછી જ મુંડે.

ગાંધીજી જેને એક વાર પોતાના ગણે તેને રામચંદ્રની પેઠે દુનિયાની વેદી પર હોમી જ હે. જો પોતાની દ્વા ખાય તો જ પોતીકાંની દ્વા ખાયને ! ગાંધીજીના આ અવૌકિક ઘેમનો આસ્વાદ, હું ધારું છું, બે જણને વિશેશે મળ્યો છે : ચક્રવર્ષી રાજ્યોપાલાચારી અને મગનલાલ ગાંધી. ગાંધીજીએ કહ્યું છે તેમ, એમણે મગનલાલભાઓને અસહ્ય રીતે કશોડી સથિતિમાં મૂકવામાં મણા રાખી નથી. શરૂઆતથી આખર સુધી એવા એવા વિચિત્ર લોકોને ગાંધીજીએ આશરમમાં ભેગા કર્યા, અને એ લોકોએ એવો તો કડવો અનુભવ મગનલાલભાઓને ચખાડ્યો, કે એમને ઠેકાણે બીજો કોઝી હોત તો સંસ્થા છોડીને ભાગી જ જાત ! આધ્યાત્મિક અને દેશસેવાની સંસ્થા ચલાવવી, એ કંઈ રમત વાત નથી. ખાંડાની ધારની અુપમા સાચે જ ફ્રાંચ લાગુ પડતી હોય, તો આવે ઠેકાણે. કશ્ટ અને અપમાન સહન કરવાં, હુરુદ્યથી મુંજાઓ જવાય એવી પરિસથિતિમાં પોતાનું કૌઠુંબિક જીવન હોમી દેવું, અને હસતે મોઢે કામ ચલાવવું, એ તો મોટો યોગ જ છે.

મગનલાલભાઓ એ આશરમના આદર્શની અને તપસ્યાની જીવતી જ્યોત છે. આજે આશરમમાં જે કંઈ સારું છે તે ગાંધીજીને નહિ પણ મગનલાલભાઓને આભારી છે. મગનલાલભાઓના સદ્ગુણો ભલે ગાંધીજીને આભારી હોય.

*

પોતે અુત્કટતાથી આગળ દોડી શકે, એટલું એમને માટે બસ ન હતું. સાથીઓને પણ સાથે રાખવા છે, તેઓ પણ પોતાનું અંગ જ છે, એ હતી ગાંધીજીની ભાવના.

ગાંધીજીનું સ્તરી-હૃદય

ગાંધીજીના વખતમાં કેટલીક સ્તરીઓ, અંગરેજી શીખીને [ભણીને] આગળ આવી. એમને વિશે ગાંધીજીને આદર હતો. એમની પાસેથી એમણે કામ પણ લીધું, પણ આ અંગરેજી શીખેલી [ભણેલી] બહેનો કનેથી એમણે બહુ મોટી અપેક્ષા રાખી ન હતી. એ કહેતા : “મારે એક મોટો ઝુઠાવ કરવો છે. એને માટે અશ્વિક્ષિત બહેનો અને અંગરેજી ન જાણનાર મધ્યમ વર્ગની બહેનોને જગાડવી જોઓશો.”

આશરમમાં ગાંધીજી બહેનો માટે ખાસ વખત કાઢવા લાગ્યા. આનું અદ્ભુત પરિણામ આવ્યું. સ્તરીઓમાં એક નવી જાગૃતિ દેખાવા લાગી. દાંડીકૂચ વખતે આશરમના ઘણાખરા પુરુશો રણાંગણ પર ઝૂતરી પડ્યા, ત્યારે આશરમ ચલાવવાની જવાબદારી બહેનોએ સંભાળી. બધાં ખાતાં સરસ સાચવ્યાં. આશરમ બહારની બહેનોએ પણ જ્યાં-ત્યાં મોટાં કામ કર્યાં. દારૂબંધીના કામમાં તો એમનો ફણો ઘણો મોટો હતો.

બાપુજીએ બહેનોને કંચી રીતે તૈયાર કરી, એ જાણવું હોય તો બાપુજીએ એમને જે પત્રો લખ્યા છે તેનો અભ્યાસ કરવો જોઓશો. [‘બાપુના પત્રો : આશરમની બહેનોને’ : સંં કાકા કાલેલકર.]

લોકોએ શરીકુશણ વિશે જે લખી રાખ્યું છે તેટલા પરથી શરીકુશણની બરાબર કલ્યાના કરી શકતી નથી. તો પણ ગાંધીજીને સમજવા માટે શરીકુશણની વિભૂતિને સમજવી અત્યંત જરૂરી છે. ગાંધીજીનું હૃદય સ્તરી-હૃદય જ હતું. સ્તરીઓમાં કોમળતા હોય છે. નમ્રતાને લીધે કહો અથવા દીર્ઘદર્શિતાને લીધે, સંઘરશને બદલે સમજૂતી પર તેમની અધિક શરદ્ધા હોય છે. અભિમાની મારણાં આગળ માથું નમાવી, એને બીજી રીતે હરાવવાની એક પદ્ધતિ એમની પાસે છે. એમનો દ્વરોહ કર્યા વગર, કારુણ્યનો સ્રોત સૂક્ષ્મા વિના સ્તરીઓ તેજસ્વિતા દાખવી શકે છે. ગાંધીજીનો અહિંસક પ્રતિકારનો માર્ગ આ સ્વભાવ માટે અનુકૂળ હતો. બીજું કે, ગાંધીજીની આગળ સ્તરીઓ તદ્દન નિસ્સંકોચપણે વાતો કરતી. એમની શક્તિ-અશ્વિક્ષિતિ ગાંધીજી જાણતા. એમની અશ્વિક્ષિતિ દૂર કરી એમની શક્તિ મજબૂત કરવાનું કામ બાપુજીએ જેવું કર્યું તેવું, શરીકુશણનો અપવાદ છોડીએ તો, બીજા કોઓ યુગપુરુશો કરેલું નથી.

*

બહેનોના બાપુ

એક વાર મેં બાપુજીને કહેલું કે, “આશરમમાં જેટલા પુરુશો આવ્યા છે તે બધા આપની પ્રકૃતિથી આકર્ષણાઓને આવ્યા છે. પણ સ્ત્રીઓ તો આશરમના આદર્શ જોખીને આવી છે એમ ન કહેવાય. એકબે અપવાદ છોડી દઈએ તો બાકીની બધી બહેનો પોતાના પતિ, પિતા કે ભાઓ—એવા જ કોકની પાછળ પાછળ આવી છે. આશરમજીવન એમને પગણે સ્વીકારવું પડ્યું છે, એ દેખીતી વાત છે. કેટલીક બહેનોના મનમાં આશરમના આદર્શો વિશે અણગમો છે. સ્ત્રીઓને સમજાવવાની ધીરજ પણ પુરુશવરૂગમાં ઓછી છે. પરિણામે સ્ત્રીવરૂગ આશરમજીવનને શિથિલ કરવાને મથતો હોય એવું લાગે છે. આનો અનુપાય આપ જ કરી શકો એમ છો.”

આના અધુર ચર્ચા ચાલી અને નક્કી કરવામાં આવ્યું કે બાપુજીએ સ્ત્રીઓનો એક વરૂગ ચલાવવો. બાપુજીએ સ્ત્રીવરૂગ માટે વખત કાઢી એમાં પોતાનો આત્મા રેઝિયો. આની અદ્ભુત અસર થાયી. સ્ત્રીઓમાં એક નવી જગ્યાતિ આવી.

એક વરસ પછી બાપુજીએ દ્રષ્ટિશાસની યાત્રા શરૂ કરી. 1927-1929, એ ત્રણ વરસ દરમ્યાન બાપુજીએ બહેનો અધુર કાગળો લખીને, સ્ત્રીમંડળનું પોતાનું જમાવેલું વાતાવરણ જાગ્રત રાખવાનો પ્રયત્ન કરેલો. બાપુજીના કાગળમાં ત્રણ વસ્તુનો સતત આગરહ દેખાય છે :

(1) સામાજિક જીવનનું મહત્ત્વ બહેનોના મન અધુર ઠસાવવું. (2) “કેળવણી એટલે અક્ષરરંનાન” એ વહેમને તોડીને “કેળવણી એટલે ચારિત્રયનું ઘડતર અને જીવનની દ્રુષ્ટિએ જરૂરી એવું પાવરધાપણું” એ નવો વિચાર માન્ય કરાવવો. (3) આપણે સમાજ અધુર ભારરૂપ ન થાયીએ અને આપણા જીવનમાં પાપ પ્રવેશ ન કરે એટલા માટે શરીરશરમ, અદ્ધ્યોગપરાયણતા, સાદાઓ અને સંયમ પ્રત્યે નિશ્ચિદ્ધ કેળવી એનું વાતાવરણ જમાવવું.

આ ત્રણ આગરહ સાથે તંબૂરાના સૂર પેઠે સ્ત્રી-સ્વાતંત્ર્યની વાત આ કાગળોમાં અખંડ આવે જ છે. સ્ત્રી ખરેખર અબળા નથી; પુરુશોની આશરિત થવાનું તેને કશું કારણ નથી; સ્ત્રી પોતાનું જીવન પોતાની બિચછા મુજબ ઘડી શકે છે અને એ રીતે જ માનવપ્રગતિમાં પોતાનો ફાળો આપી શકે છે—એ જાતની શિખામણ બહેનોની શક્રતિ પ્રમાણે એમને આપતા બાપુજી થાકતા જ નથી.

આશરમમાં કોક કોક વાર ચોર આવતા એ પ્રસંગનો લાભ લાયી બાપુજીએ પ્રશ્ન છેડ્યો કે ચોર આવે ત્યારે બહેનો શું કરે ? આશરમમાં જો પુરુશો ન હોય તો બહેનો પોતાનું રક્ષણા કરે કે નહીં ?

પુરુશો પોતાની ભોગલાલસાને પ્રધાનપદ આપી સ્ત્રીઓનું જીવન એકાંગી, પરાધીન અને કૃત્તિમ બનાવ્યું. પુરુશની સ્વામિત્વબુદ્ધિને કારણે જ સ્ત્રીજીતિ અભણા, અસહાય અને અનાથ ગણાયી. એ બધું ધ્યાનમાં લેતાં સ્ત્રીકૃષાની છેલ્લી જવાબદારી પુરુશોની જ છે, એ સ્વીકારતાં છતાં બાપુજી હુદે છે કે, અત્યારે ભલે તમે પોતાની મેળે પોતાની રક્ષા ન કરી શકો; પણ એ શક્તિ તમારે ધીરે ધીરે કેળવવાની તો છે જ.

આ કાગળોમાં ગાંધીજીએ ઘણી સાવચેતીથી પોતાની સૂચનાઓ મૂકી છે. જેટલું ગળે આત્મે, સર્વવાનુમતે કરવાનું નક્કી થાય, તેટલું જ કરજો — એ અભયદાન તો ડગલે ને પગલે આપેલું જ છે.

એમણે પ્રારંભ કર્યો છે સમયપાલનના આગરહથી. પ્રારૂથનામાં આવવું જ છે, તો તે વખતસર આવવું જોઓઓ. પ્રારૂથનામાં ધ્યાન પરોવવું, શલોકો મોઢે કરવા, અુચ્ચારણ તરફ ખાસ ધ્યાન આપવું, એ બધું ધીમે ધીમે આવી જાય છે. પ્રારૂથનામાં જવાનું નક્કી કર્યા પછી અસાધારણ મુશ્કેલી વગર એ ન ટળાય. જે માથે લીધું અનું પાલન થવું જ જોઓઓ.

કુટુંબભાવના કરતાં વ્યાપક એવી સામાજિક ભાવના સ્ત્રીઓમાં કેળવવાનો ગાંધીજીએ પ્રયત્ન કર્યો છે. પછી ધીમે ધીમે એમને રસોડું સોંખ્યું છે. રસોડા સાથે કોઈાર આવી જ ગયો. કોઈાર સાચવતાં હિસાબ રાખવાની વાત આવી. એટલે એની કેળવણી મેળવે જ છૂટકો. આટલે સુધી પહોંચ્યા પછી સ્ત્રીઓને બાળમંદિર સોંપી દેવાની બાપુજીએ પેરવી કરી.

સ્ત્રીઓની કેળવણીની બાબતમાં બાપુજીએ બહુ હળવો કાર્યક્રમ એમની આગળ રાખ્યો છે : લખવા-વાંચવાનો મહાવરો રાખો, અફ્કશર સુધારો, અુચ્ચારણ શુદ્ધદ્વારા; નામું લખવું એ કાંઓ અધરી વાત નથી; એને માટે સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર—એટલું ગણિત આવડવું જોઓઓ.

ત્યાર પછી આવે છે અનુદ્યોગમંદિરની કેળવણી : આપણે ધીરે ધીરે જેડૂત, વણકર, ભંગી અને રબારી થવાનાં છીએ. એમ જરૂરી કેળવણીનાં અંગો સ્ત્રીઓ આગળ એમણે મૂક્યાં છે. પણ બાપુજીનો મુખ્ય આગરહ છે કે સાચી કેળવણી તે હુદુદ્યની જ છે. એને માટે પહેલી વાત નિરભયતાની છે. જન્મમુત્યુનો હુદુશશોક છોડી દેવો જોઓઓ. પુરુશ વગર આપણે અસહાય ધીએ, એ ખ્યાલ સૌથી પહેલો કાઢી નાખવો જોઓઓ. એને માટે ઘરેણાં અને શાણગાર બંને છોડી દેવાં જોઓએ. સાચું સૌંદર્ય હુદુદ્યમાં છે, એ કેળવીએ. સાચી કળા સાઢી અને સ્વાભાવિક હોય છે. સુધૃત્તામાં, વ્યવસ્થિતતામાં ઘણીખરી કળા આવી

જાય છે.

સ્ત્રી-સંગઠનમાં જ્યારે શિથિલતા આવી, ત્યારે ગાંધીજીએ સ્પશ્ટ કહ્યું કે નિયમો મોળા નહીં કરતાં; નિયમો મોળા કરી લાગુ પાડવા કરતાં એ કાઢી નાખવા એ સારું છે.

દરેક પ્રસંગે અંતરમુખ થવાની કળા બાપુજી શીખવે છે. ચોરોની ચર્ચા કરતાં એમણે અચૂક કહી દીધું છે કે, આપણે અપરિંગરહક્તતનું પાલન બરાબર કરતાં નથી અને ગફ્ફલતમાં રહીએ છીએ, તેથી જ ચોરી થાય છે.

બાપુજીને એક જ વાત સ્ત્રીઓ આપર ઠસાવવી છે કે, આશરમમમાં તૈયાર થાઓ, પાવરધાં થાઓ, નિરૂભય થાઓ, અને લાચાર સ્ત્રીવરૂગની સેવા કરવા નીકળી પડો. ગાંધીજીએ અસાધારણ રીતે સ્ત્રીહૃરુદ્ય કેળવ્યું હતું તેથી જ તેઓ સ્ત્રીઓના હૃરુદ્ય સુધી પહોંચી શકતા હતા.

*

સરકાર જ અન્યાય કરે ત્યારે

માણસે કોઝી ગુનો કર્યો, તો એને સરકાર સજા કરે છે. સજામાં દુખ અને નુકસાન આપરાંત સામાજિક અપ્રતિશ્ઠા પણ મહત્વનો ભાગ ભજવે છે.

પણ સરકાર પોતે જ જ્યારે અન્યાય કરે, ત્યારે એ સરકારને જ અપમાનિત કરવાનો એક અહિસ્ક ભિલાજ ગાંધીજીએ શોધી કાઢ્યો. સરકારનું કામ અન્યાયી હોય ત્યારે એ સરકારની જાહેર રીતે જાટકણી કાઢવી, અને એ સરકાર પ્રત્યેનો અસંતોશ તીવ્રપણે અમલમાં આપવા માટે કોઝી એવું “બે-કાયદા” કામ કરવું, જેમાં અનીતિ ન હોય. તે વખતે માણસ જાહેર કરે : મેં છદેચોક આ પાપી સરકાર સામે ગુનો કર્યો છે, અને એને માટે સરકાર જે સજા કરશે તે ખુશીથી ભોગવવા તૈયાર છું. આવું કરીએ એટલે સરકાર સજા કરવાની. પણ આથી “ગુનેગાર”ની સામાજિક પ્રતિશ્ઠા તૂટતી નથી. ઔલટું, સરકાર જ અપ્રતિશઠિત થાય છે.

*

જીવનના કલાકાર

કઅં વસ્તુ સાથે શું શોભે છે, કઅં વસ્તુ બીજી કોઅં વસ્તુ પાસે મૂકવાથી, પોતે સુંદર હોવા છતાં, વિશી લાગે છે— આ સૂક્ષમ વિવેક જેના જીવનમાં, જીવનની છેક નાનીનાની વાતોમાં, બોલવામાં-ચાલવામાં, હસવામાં, બધી જ વાતોમાં ખરગટ થાય છે એને આપણે સંસ્કારી માણસ કહીએ છીએ.

શાંતિનિકેતનમાં હતો ત્યારે મેં રવીન્દ્રનાથના જીવનમાં આ જાતની સંસ્કારિતા જોઅં હતી. એમનું જીવન મેં અત્યંત નજીકથી જોયું છે. પત્ર લખતાં, લેખ લખતાં, ચરૂચા કરતાં, એમના દરેક વ્યવહારમાં આરૂપ્યતા કે ઔચિત્યનો ભંગ કરી થયો નથી. નારાજી, ચીડ વ્યકૃત કરતી વખતે પણ તેઓ કરી જીવનકળાની મરૂયાદા ભૂલ્યા નહિએ.

ગાંધીજી તો જીવનના એક મોટામાં મોટા કળાકાર રહ્યા. તેમાંય ઔચિત્ય તરફ તેઓ અધિક ધ્યાન દેતા. એક વાર એમે બાપુજીને સિંધમાં ફરુપાલાનીજીના આશરમમાં લાયી ગયા. તે વખતે તેઓ કાઠિયાવાડી પદ્ધતિનાં કપડાં પહેરતા : ધોતિયું, પહેરણ, અધરાણું અને પાઘડી. નીકળતી વખતે બાએ એમની સૂટકેસ ભરી આપી હતી. પણ અનુતાવળમાં બા પાઘડી મૂકતાં ભૂલી ગયેલાં. સિંધુ બરહમચરૂયાશરમ પહોંચ્યા પછી ગાંધીજીના ધ્યાનમાં આ આવ્યું. એટલે એમે બજારમાં જાઓ સહેદ કપડું લાયી આવ્યા. આ કપડું સહેદ તો હતું પણ નવું હતું, અને ધોતિયું-પહેરણ વગેરે વાપરેલાં હોવાથી એ કપડાનો રંગ જુઈ જાતનો હતો. ગાંધીજીને સહેદ રંગનો આટલો અમથો ફેર પણ ખૂંચ્યો. એમે આખી રાત બેઠા. નવા કપડાને ત્રણ-ચાર વાર ધોયું. જ્યારે તેનો રંગ પહેરણના રંગ સાથે “મેચ” થયો, ત્યારે જ બાપુજીએ એનો પાઘડી તરીકે અધ્યયોગ કર્યો. આટલી નાનકડી વાતોમાં પણ બાપુજી અત્યંત ચોખલિયા હતા.

*

સામાજિક અન્યાય, ગરીબોનું અપમાન, અસહાય લોકોની વિંબના ગાંધીજી સહન કરી શકતા ન હતા. હિસાને અન્તેજન આખ્યા વગર અને દૂવેશને કોઈ આખ્યા વગર બળવો કેમ કરવો, એ કળામાં ગાંધીજી ખ્રીણ હતા. જે લોકો હજારો વરસોથી દબાયેલા છે, એમને માટે લડતાં ગાંધીજીને શૂર પચતું. એમના દોશો કેટલા છીછા હોય છે, અને એમની ભલાઅી કેટલી આંડી હોય છે, એનો ગાંધીજીને પૂરતો ખ્યાલ રહેતો.

જીવનકલાનું પ્રધાન લક્ષ્ણાણ

સેવાગ્રામમાં એક દિવસ સેવાદળના સ્વયંસેવકો ગાંધીજીને મળવા આવ્યા. દુરિલ અને કવાયતની તેમની સુંદર તૈયારી ગાંધીજીને દેખાડી તેમના આશીર્વાદ લેવા હતા. ગાંધીજીએ કવાયત વગેરે જોઅની પોતાનો સંતોશ વ્યકૃત કર્યો. સંચાલકે બે શબ્દ કહેવાની ગાંધીજીને પ્રાર્થના કરી. સ્વયંસેવકો દૂર કતારમાં બેઠા હતા. ગાંધીજીએ કહ્યું : “મારા બે શબ્દ સાંભળવા હોય તો નજીક આવો.”

સૂચના સાંભળતાં જ બધાં સ્વયંસેવકોનું ટોળું હુડ્ડડ કરતું આભું થયું અને ગાંધીજીની નજીક અવ્યવસ્થિત રીતે આભું રહ્યું.

ગાંધીજીએ કહ્યું : “તમે લોકો તાલીમબદ્ધ છો. કતારમાં કેમ ચાલવું, કેમ દોડવું, એનો સુંદર પ્રયોગ હમણાં જ તમે દેખાડ્યો હતો. તમે લોકો જ્યાં બેઠા હતા ત્યાંથી મારી પાસે આવવામાં એ જ વિદ્યા કામે લગાડી હોત, તો મને ખૂબ આનંદ થત. કતારમાં રહીને આભા થાઓ જડપથી ચાલતા મારી નજીક આવી અર્દ્ધા વરતુળમાં આગળના લોકો બેસી ગયા હોત, અને પાછળવાળા આભા રહ્યા હોત, તો તમારી કવાયત કામમાં આવી હોત. કવાયત માત્ર દેખાડવા માટે નથી, રોજબરોજના જીવનને વ્યવસ્થિત કરવા માટે હોય છે.”

*

હુનિયામાં જેટલું જ્ઞાન, જેટલું કૌશલ અને વ્યવસ્થાશક્તિ આપણે પ્રાપ્ત કરીએ છીએ, તે કસોટીને સમયે કામ આવી શકે તો જ એની કિંમત છે. કલાની બાબતમાં તો આ વાત વિશેશપણે લાગુ પડે છે. કલા એ વ્યવસ્થા, સુંદરતા, સંયમ, પ્રસંગતા અને કરકસર પણ છે.

કાશ્મીરના એક પ્રસિદ્ધ કવિએ સાહિત્યકલાનું વર્ણણ કરતાં અલંકાર અને રસથી અુપરનું સ્થાન ઔચિત્યને આપ્યું છે. તે કહે છે કે કાવ્યરસ સિદ્ધ ભલે થયો હોય, એમાંથી જ્યારે ઔચિત્ય પ્રગટે છે ત્યારે જ સાચું કાવ્ય બને છે.

ઔચિત્ય કાવ્યનું પ્રધાન લક્ષ્ણાણ તો છે જ, પરંતુ જીવનકલાનું પણ તે જ પ્રધાન લક્ષ્ણાણ છે. કચી ચીજ સાથે કચી ચીજનો મેળ રહે છે, કચા અંશાનું કેટલું પ્રમાણ હોવું જોઅનીએ, કચી ચીજ બીજી કચી ચીજના સહવાસથી, સ્વયં સુંદર હોવા છતાં પણ સૌંદર્યપૂર્ણ બને છે, તેનું સૂક્ષ્મ જ્ઞાન જ્યારે રોજિંદા જીવનમાં આતુરે છે ત્યારે જ સમજવું જોઅનીએ કે તે વ્યકૃતિ પૂર્ણરૂપથી સંસ્કારી છે.

માણસ અંચ્યામાં અંચ્યા કુળનો હોય અથવા નીચા કુળનો હોય, પણ જ્યારે તે પોતાની

વાચચીતમાં, રોજબરોજના જીવનવહારમાં અને નાનમોટાની સાથે સમાગમમાં આવતાં પોતાની સંસ્કારિતા ખગટ કરે છે, ત્યારે જ તેની સાચી કુલીનતા ખગટ થાય છે.

શાંતિનિકેતનમાં હું પાંચ-છ મહિના રહ્યો. એ દરમ્યાન કવિવર રવીન્દ્રનાથને રોજબરોજના જીવનમાં અનેક સ્વરૂપે અને નજીકથી જોવાની તક મળી. ભાશામાં, અંગપ્રત્યંગના હાવભાવ અને દરેકની સાથેના વર્ણતાવમાં તેમની કલાત્મકતા સુંદર રૂપે ખગટતી હતી. ખસન્તા, નારાજી અથવા ગુર્સો વ્યકૃત કરવામાં પણ તે કદી જીવનકલાની મર્યાદા ભૂલતા નહીં. રોજબરોજની એમની અધ્યયોગની ચીજો, કપડાં, લેખનસાહિત્ય, બધાંમાં તેમની કલાત્મક અભિરૂચિ વ્યકૃત થતી હતી; અને હવે તો દુનિયા જાણે છે કે કવિતા બનાવતાં કાગળ પર તેમને જે કાપકૂપ કરવી પડતી રેને પણ તેઓ કલાત્મક રૂપ આપી શકતા.

આ કલાત્મકતા કેવળ ભાશા, અવાજ, હલનચલન, હાવભાવ અને રીતન્નિવાજમાં જ નહીં, પરંતુ સામાજિક, આર્થિક, રાજનૈતિક અને સામૂહિક જીવનમાં પણ વ્યકૃત થવી જોઓઅને. એટલે સુધી કે વિપરીત વસ્તુનું જીવનમાં સ્થાન જ રહે નહીં. અનુત્તમ ગવૈયાના મુખેથી કર્કશ વિસંવાદી સ્વર નીકળશે જ નહીં. કોલાહલમાં પણ તે તાલબદ્વધતા લાવશે, અને ખાણ છોડતી વખતે અંતિમ શવાસ પણ સમના ઠેકા પર જ છોડશે.

*

એક પુસ્તક માટે અપવાદ

ગાંધીજીને મારું લખાણ વાંચવાની તસદી મેં પોતે કોઝી દી આપી નથી. એક અપવાદ યાદ આવે છે. એક વાર બાપુજી માંદા પડ્યા હતા. ડોક્ટરે એમને સુગમ અને મનોરંજક પુસ્તકો જ વાંચવાની રજા આપી હતી. એમણે આશરમના પુસ્તકાલયમાંથી ‘ભદ્રાંભદ્ર’ પુસ્તક મંગાયું. એમના હાથમાં એ પુસ્તક જોઝી મેં પૂછ્યું : “આપ આવાં પુસ્તકો વાંચવા માટે વખત કાઢી શકતા હો, તો મેં આપનો શો અપરાધ કર્યો છે ? મારું ‘ઓતરાતી દીવાલો’ પુસ્તક આપ કેમ ન વાંચો ?”

એમણે પૂછ્યું, “એમાં શું છે ?”

મેં કહ્યું, “વરસાદ, પવન, કાગડા, કીડી જેવી સુશટિ-નિરીક્ષણાની કેટલીક વાતો છે.”

એમણે એ પુસ્તક મંગાવી વાંચી લીધું, અને ખુશ ખુશ થાયા. કહેવા લાગ્યા : “આપણાં [નવજીવન પ્રકાશન મંદિરનાં] બધાં પ્રકાશનો સાદાં અને સર્સાં હોવાં જોઝીએ, એવો મારો આગરહ હોય છે. પણ ‘ઓતરાતી દીવાલો’ માટે હું અપવાદ કરવા તૈયાર છું. અુત્તમ કાગળ, સુંદર છિપાઅી અને અુત્કરુશ્ટ ચિત્રો આપી આ પુસ્તક શાંગારવું જોઝીએ..”

મેં પૂછ્યું, “આવી આવુત્તિ કાઢીએ, તો આપ તેની પ્રસ્તાવના લખી આપશો ?”

તેઓ બોલ્યા, “અવશ્ય. કલાની વસ્તુ છે. એની કદર તો થવી જ જોઝીએ..”

*

પુસ્તક-ભંડાર

ગાંધીજીએ કાકા કાલેલકર પર તા. 30-7-42એ (એટલે કે ઓગસ્ટમાં ‘હિંદ છોડો’ની આખરી લડત શરૂ થાયી તે અગાયુ થોડા દિવસે જ) લખેલા પત્રમાં એક વાક્ય હતું : “આપણે એક પુસ્તક-ભંડાર રાખવો જોઝીએ, જેમાં આપણે પસંદ કરેલાં પુસ્તકો વેચી શકાય.]

બાપુજીની પુસ્તક-ભંડાર રાખવાની યોજના ઘણી મહત્વની છે. એ પરમાણે પુસ્તક-વેચાણ દ્વારા સેવા કરવાના મેં અનેક વાર પ્રયત્ન કર્યા. મને એમાં ખૂબ રસ હતો. આ જ કામને વરેલો કોઝી સાથી મને મળી જત, તો એને કેળવી એક “આદર્શ બુક સેલિંગ એજન્સી” ધીકરી કરી બતાવવાની અન્યથા હતી. હજી પણ માનું છું મારામાં એ શકૃતિ છે. પણ એની તક મને મળી નથી.

“ત्याग कરूयो होय तो—”

1915ની આખરની વાત હશે. બાપુ કાંઈક લખતા હતા. હું પાસે બેઠો બેઠો અનુમર ખથ્યામની ‘રૂબાયત’નો [અંગરેજી] તરજૂમો વાંચતો હતો. ફિટ્રિકરાહણા અનુવાદનાં વખાણ મેં બહુ સાંભળ્યાં હતાં, પણ એ વાંચ્યો નહોતો. ચોપડી પૂરી થવા આવી હતી, ત્યાં બાપુનું ધ્યાન મારા તરફ ગયું. “શું વાંચ્યો છો ?” તેમણે પૂછ્યાં. મેં ચોપડી બતાવી.

નવીસવી ઓળખાણ થયેલી. બાપુ સીધો અસ્પદેશ આપવા માગતા નહોતા. ઝૂંડો નિસાસો નાખી તેમણે કહ્યું : “મને પણ અંગરેજી કવિતાનો બહુ શોખ હતો. પણ મેં વિચાર કરૂયો કે મને અંગરેજી કવિતા વાંચવાનો શો અધિકાર ? મારી પાસે વખત ફાજલ રહેતો હોય, તો હું મારી ગુજરાતી લખવાની શકૃતિ કાં ન વધારું ? દેશની સેવા કરવી હોય તો મારો બધો વખત મારી સેવાશક્તિ વધારવામાં રોકવો જોઓએ.”

થોડી વાર થોભી પાછા બોલ્યા : “દેશસેવાને કાજે મેં ત્યાગ કરૂયો હોય તો તે અંગરેજી સાહિત્યના શોખનો. પૈસા અને ‘કરિયર’[કારકિર્દી]ના ત્યાગને તો હું ત્યાગ ગણતો જ નથી, એ તરફ મને કદી બેંચાણ જ નહોતું. પણ અંગરેજી સાહિત્યનો શોખ પાર વગરનો હતો. પણ મેં નિશ્ચય કરૂયો છે કે એ શોખ મારે છોડવો જોઓએ.”

હું સમજી ગયો, અને ચોપડી બાજુએ મૂકી દીધી.

*

અવતારી પુરુષ નહીં

ગાંધીજી મનુષ્યમાં જે જે વિકાર આવી શકે, તેને તેઓ આધીન હતા. ગાંધીજી જો અવતારી પુરુષ હોત તો, હું રૂદ્ધયને સાક્ષી રાખીને હું કહું છું કે, તેમને હું ન પૂજત. સમાજ જેમને અવતારી પુરુશો ગણે છે એવાઓના ગાઢ પરિચયમાં આવવાનું સદ્ગુરૂભાગ્ય મને પ્રાપ્ત થયું છે. એવા લોકો વિશે મારા મનમાં આદર છે. પણ ગાંધીજીએ જેટલી શરદ્ધા ડેળવી છે, તેટલી તો હું ક્રયાંયે જોઓણી શક્યો નથી.

ગાંધીજીની મહાવીર, બુદ્ધ કે શ્રીકૃષ્ણની જોડે હું સરખામણી નથી કરતો. પણ તેમણે જે ધર્મ પ્રવર્તતાવ્યો છે તે જૈન ધર્મ, બૌધ્ધ ધર્મ અને ભાગવત ધર્મનો નિશ્ચકરૂશ છે અને તેથી એ તરણે કરતાં ચિદ્યાતો છે, એમ હું માનું છું.

તારાઓનો સ્વાદ

1930માં બાપુજી સાથે વરોડા જેલમાં હતો, ત્યારે રેન્ટિયો કાંતવાની કળા અને એના સુધારા તરફ બાપુજીનું ભેજું ચાલતું.

જેલમાં અમને રાત્રે ખુલ્લામાં સૂવાની છૂટ હતી. એનો લાભ લખીને મેં મારો માનીતો વિનોદ ચલાવ્યો. તારાઓ સાંજે આકાશમાં દેખા દે, નવા નવા પૂર્વ તરફ ઔગે, આખી રાત આકાશની મુસાફરી કરી સવારે આથમતા જાય, એ જોવાની મને મજા પડતી. સત્તાવીસ નક્ષત્રો, એમના આકાર હું બરાબર જાણું. આકાશના પંથમાં દિવસે સૂર્યની અને રાત્રે ચંદ્ર ને ગરૂની ગતિ જોવાની મને મજા પડે.

આવો આનંદ બાપુજીને પણ આખ્યા વગર મારાથી કેમ રહેવાય ? એટલે રાત્રે સૂતાં પહેલાં અને સવારે પ્રકાશ થાય તે પહેલાં ગરૂનો અને નક્ષત્રો તરફ બાપુજીનું ધ્યાન હું ખેંચ્યું. મને નિરાશા ન કરવા માટે બાપુજી એ બધું જોતા ખરા, પણ એમને ખરેખર રસ જમ્યો ન હતો.

દિવસે બાપુજીને નવરા જોયું, એટલે તે તે દિવસે ચંદ્ર અને ગરૂનો કયાં કયાં નક્ષત્રોમાં હોય છે તે પણ બાપુજીને આપણા પંચાંગમાંથી સમજાવું. ત્યાર પછી પૂનાના અમારા સ્નેહી ખરો. તરિવેદી પાસેથી મેં પશ્ચિમના જ્યોતિશશાસ્ત્રની ચોપડીઓ મંગાવી. આકાશના તારાઓના નક્ષા મંગાવ્યા. એ પણ બાપુજીને બતાવ્યું. બાપુજીને થતું હશે કે આપણો સાથી આટલા અનુત્સાહથી સમજાવે છે, ત્યારે એમાં કાંચીક તો રસ બતાવવો જ જોઈશે !

પછી તો જેલમાંથી હું છૂટ્યો. બાપુજી પણ છૂટ્યા અને ફરી પકડાયા. 'બત્રીસની સાલમાં કોણ જાણે શી રીતે બાપુજીને આકાશના તારાઓનો સ્વાદ એકાએક વળગ્યો. પછી તો પૂછિવું જ શું ? એમણે જાતજાતની ચોપડીઓ મંગાવી. પોતે વાંચે, અને હું જે જેલમાં હોયું ત્યાં મારે માટે મોકલાવે. કાગળ લખવાની સગવડ હોય ત્યારે આકાશના તારામાં પડતી મજાનો અન્દેખ કરે અને કોક વાર માહિતી પણ પૂછે. 1932ની લડતમાં મારે અનેક જેલોમાં જવું પડ્યું હતું. તેમાં આકાશના તારાઓનો આનંદ તો હું મેળવતો જ હતો. પણ “બાપુજી સાથેની આનંદની આપદે”નો આનંદ તો અનેરો અને અનેકગણો રહેતો.

સ્વરાજ-સાધનાના ચિંતનમાં મશાગૂલ બાપુજીને તારાઓમાં રસ પમાડવો સહેલો ન હતો. આગળ જતાં એ રસ એકદમ જાગ્યો. પછી પ્રાર્થના-પ્રવચનોમાં તારાદર્શન અને એની આધ્યાત્મિક અસર વિશે બોલવા લાગ્યા.

[કાકાસાહેબ પરના ગાંધીજીના એ અરસાના પત્રોના કેટલાક અંશ :]

પરવડા મંદિર, 3-6-1932

આકાશદ્રોશનમાં ઠીક ખૂંચ્યો છું. હવે તમારી સાથે વાત કરતાં છેક મૂઢ જેવો ન લાગું; મારા હાથમાં પુસ્તકો આવ્યાં તેમાં હજુ લગી વધારેમાં વધારે અપયોગી *Flamellia*નું જણાયું છે. એક સારું પુસ્તક ગુજરાતીમાં હોવું જોઈએ. અને તેમાં ખગોળશાસ્ત્રનું જ્ઞાન પણ હોય. આપણે ત્યાં બે નોખાં પુસ્તકો ન પોસાય. આપણે તો ખગોળનું શાસ્ત્રીય જ્ઞાન અને અનુભવ, બંનેનું મિશરણ જોઈએ. તમે અહીં હોત, તો એવા પુસ્તકનું કામ તમારી પાસેથી લેત. અને હું એમાં ઠીક ઠીક ફાળો આપત. મારું જ્ઞાન અત્યંત કાચું ન હોત, તો હું પોતે લખવા બેસી જાત. એવો રસ મને એમાં લાગ્યો છે. અને આ શાસ્ત્રની ધાર્મિક અપયોગિતા હું જોઈ ગયો છું.

*

પરવડા મંદિર, 23-7-1932

આકાશદ્રોશનથી રાતરિનો વખત જાણી શકાય, અથવા તો જરૂરો અને તારાગણોનો સંબંધ વૈદિક દેવતાઓની સાથે છે, એ વિશે મેં જ્યાલ નહોતો કર્યો. એ બધું રસીક છે. પણ મારો રસ જુદા જ પ્રકારનો છે. આકાશને નિહાળતાં જ અનંતતાનો, સ્વચ્છતાનો, નિયમનનો, ભવ્યતાનો જ્યાલ આવે છે, એ આપણાને શુદ્ધધ કરે છે. જરૂરોને અને તારાઓને પહોંચી શકીએ, અને ત્યાં પણ ભલે કદાચ પુષ્ટીની અધ્યર સારા-નરસાનો અનુભવ થાય છે તેવો થાય. પણ દૂરથી તેમાં જે સૌંદર્ય રહેલું છે અને ત્યાંથી જે શીતળતા છૂટી રહી છે તેની શાંત અસર પડે છે, એ મને અલોકિક લાગે છે. અને આકાશની સાથે આપણું અનુસંધાન કરીએ એટલે ગમે ત્યાં બેઠા હોઈએ તેની કાંચી હરકત ન રહી. એ તો ઘેર બેઠાં ગંગા આવ્યા જેવું થયું. આ બધા વિચારોએ મને આકાશદ્રોશન-ઘેલો કરી મૂક્યો છે, અને તેથી મારા સંતોશ પૂરતું જ્ઞાન મેળવી રહ્યો છું. જેમસ જીન્સનાં ત્રણ પુસ્તકો પ્રો. તરિવેદીએ મોકલ્યાં. તેમાંનાં બે મોટાં વાંચી ગયો. મને બંને ગમ્યાં.

[જેમસ જીન્સ (1877-1946) : અંગેજ ખગોળશાસ્ત્રી અને લેખક. અમેરિકાની વિખ્યાત વિલ્સન વેધશાળામાં 1923-44 દરમ્યાન. બીજા અભ્યાસી જરૂર્થો અધ્યરાંત વિજનાનને લોકભોગ્ય બનાવનારાં પુસ્તકો લખ્યાં : ‘યુનિવર્સ એરાઓન્ડ અસ’ (1929), ‘સ્ટાર્સ અન ધેર કોર્સીઝ’ (1931), ‘થ્રુ સ્પેચીસ એન્ડ ટાય્થીમ’ (1934)—સંપાદક]

હવે જરા ખગોળનો પદ્ધતિસર અભ્યાસ કરી રહ્યો છું. અત્યારે ખરાસનું પુસ્તક વાંચી રહ્યો છું. લેખકે એ પુસ્તક પર સરસ મહેનત લીધી લાગે છે. ચિત્રો પુશ્કળ છે, એ બહુ મદદકરૂતા છે.

*

યરોડા મંદિર, 26-8-1932

તમે જે ચોપડીઓની નોંધ કરી છે, તેમાંની ત્રણ તો હીરાલાલે મને મોકલી છે : ‘સ્ટેલર મેપ્સ’, ‘ભગોલચિત્તમ्’, ‘હિંદુ એસ્ટ્રોનોમી’. મારી પાસે તો ખગોળવિદ્યાનાં પુસ્તકોનો એક સારો ભંડાર થથી રહ્યો છે. સવારનાં નક્શાત્રોનાં તમે નામ આપ્યાં છે એ બધાં સહેજે હું ઓળખી લાયું છું. થોડુક તો રોજ વંચાય છે જ. તમારાં પ્રકરણો અનુપર આંખ ફેરવી ગયો છું. ઝૂંડા આત્મરૂપા વિના તેમાં એક વસ્તુનો અભાવ જોઅનું છું : પશ્ચિમના ખગોળશાસ્ત્રીઓનાં નામ અને ટૂંકાં જીવનબૃત્તાંત. કેટલાંક તો બહુ સાહસિક અને પુષ્યજીવન છે એમ લાગે છે. આપણું ખગોળ વિશેનું પુસ્તક વથાસંભવ પૂર્ણ હોવું જાઓએ. વળી આપણું પુસ્તક એવુંયે ન થવું જોઓએ કે જે બહુ ભણેલા જ સમજી શકે. ગામડિયાઓને દ્રુષ્ટિની સામે રાખીને લખાયેલું હોવું જોઓએ.

[‘ભગોલચિત્તમ्’ : સંસ્કુરુતના ત્રણ શબ્દો : ભ = અવકાશના તારા, ખ = આકાશ, મૂ = ઘૂષ્યી. આ પ્રમાણે ઘૂષ્યીના દેશોના નક્શાઓ જેમાં છે, તેને ‘ભૂગોલચિત્ત’ કહી શકાય. આકાશના સૂર્ય, ચંદ્ર, રૂહ, તારા, નક્શાત્ર, આકાશગંગા વગેરેની વિદ્યાને જીવોત્તિશ અથવા ખગોળ-વિદ્યા કહે છે. અને જેમાં આકાશના તારાની આકુરુતિઓ વગેરે આપે છે તેને ‘ભગોલચિત્તમ્’ કહે છે.—કા.કા.]

*

યરોડા મંદિર, 20-9-1932

જીન્સનાં ત્રણ પુસ્તક મને બહુ ગમ્યાં. એ મારે તો બે-ત્રણ વાર વાંચવાં જોઓએ. ઘણી વસ્તુનું ચિત્ર મારી સામે ખડું નથી થયું. છતાં હવે એમાં રસ જામ્યો છે !

*

યરવડા મંદિર, 12-2-1933

હું તો હમણાં ત્રણ વાગ્યે આહું છું એટલે ગુરુ, મંગળ માથે બિરાજતા હોય છે. આકાશદર્શનનો રસ ચાલું જ છે. સોમવારે મોટું દૂરબીન આવવાનું છે.

*

“આ દુર્દશા દૂર કરો !”

‘નવજીવન’માં જ્યારે [થોડું] લખાણ ખૂટે, ત્યારે સ્વામી આનંદ મારી પાસે કંચીક લખાવીને તેને ટીકઠાક કરી છાપી દે. પણ 1922માં બાપુ જેલમાં ગયા, ત્યારે મારે આખું ‘નવજીવન’ ભરી આપવું પડતું હતું.

જેલમાં બાપુએ સાંભળ્યું હશે કે ‘નવજીવન’નું કામ હું સારી રીતે સંભાળ્યું છું. એટલે એક દિવસ તેમનો પત્ર આવ્યો : “અંગરેજીમાં શબ્દોની જોડણી નિશચિત હોય છે, તેમ ગુજરાતીમાં નથી. ગુજરાતીમાં જેને જેમ ફાતે તેમ જોડણી કરે છે. એની આ દુર્દશા દૂર કરવાનું કામ તમારું છે. મને એવો કોશ બનાવી આપો કે જેમાં ગુજરાતીના બધા શબ્દો હોય અને દરેક શબ્દની શુદ્ધ જોડણી નિયમ પ્રમાણે આપવામાં આવી હોય.”

બાપુ છૂટ્યા, મળ્યા ત્યારે મેં કહ્યું, “બાપુજી, આવી અપેક્ષા તમે મારી પાસે કેવી રીતે રાખો ? ગુજરાતી નથી મારી જન્મભાશા; વ્યાકરણ તો મને આવડતું જ નથી.”

બાપુ બોલ્યા : “એ તો ખરું. પણ જેની મદદ જોઓએ તેની લો. મેં એ કામ તમને સોંપી દીધું છે. તમારી પાસે માગીશ. આ વસ્તુનું મહત્ત્વ સમજો, અને ખામી વગરનો કોશ તૈયાર કરી ગુજરાતીની જોડણીને વ્યવસ્થિત કરી આપો.”

મેં માથું નમાયું. હું ગુજરાતીનું વ્યાકરણ લખીને બેઠો. પાછલાં ચાળીસ વરસમાં જોડણી વિશે જે જે ચર્ચા થયેલી, તે બધી એકઠી કરી. મહાઠેવભાસી, નરહરિભાસી અને હું પોતે, એમ ત્રણ જણાની સમિતિ નીમી. આગળ જતાં એ કામ વિદ્યાપીઠને સોંપી દીધું. અને અનેક મિત્રોની મદદથી આખરે પાંચ વરસની મહેનત પછી બાપુને એક શુદ્ધ ‘જોડણીકોશ’ અરૂપણ કર્યો. એ કોશની પહેલી આવૃત્તિ 1929માં બહાર પડી, તેમાં 43,783 શબ્દોની ફૂક્ત શુદ્ધ જોડણી આપવામાં આવી હતી.

બાપુ બહુ રાજી થયા. ‘નવજીવન’માં એમણે લખ્યું કે, “હરે પછી સ્વેચ્છાએ જોડણી કરવાનો કોઓને અધિકાર નથી.” ભલભલા વિદ્વાનોએ જોઓ લીધું કે ગાંધીજીએ ગુજરાતીની જોડણી સથિર કરવા આ ભારે કામ કર્યું છે, તેથી તેમણે ગાંધીજીનો અધિકાર માન્ય રાખ્યો.

પણ એ તો કેવળ જોડણી પૂરતો શબ્દકોશ થયો. સામાન્ય લોકોને અરૂથ વગરના કોશનો અનુપ્યોગ શો ? એ કામ મેં મગનભાસી દેસાઓને સોંપ્યું. એ પ્રમાણે ‘સારૂથ જોડણીકોશ’ 1931માં તૈયાર થયો. સોથી પહેલાં વડોદરા રાજ્યે અને માન્યતા આપી, ત્યાર પછી ગોડલના રાજ્યે, પછી મુંબાસી યુનિવર્સિટીએ ને મુંબાસી રાજ્યે. “શબ્દરચના હરીક્ષાસી” ચલાવનાર લોકોએ પણ વિદ્યાપીઠની જોડણીને જ પોતાની માન્યતા હોવાનું

જાહેર કર્યું.

કેટલાક વિદ્વાનોએ મને સૂચયું કે, જોડણીના જૂના નિયમોમાં સુધારા કરી નવેસરથી એક જોડણીકોશ તૈયાર કરવાની જરૂર આમી થાયી છે. અંગરેજીની જોડણી માટે એમ અમેરિકામાં અમુક સુધારાની પ્રવૃત્તિ ચાલે છે, તેમ ગુજરાતમાં પણ સર્વમાન્ય અદ્યતન સુધારા [કરાય] તો અમે રાજી થશું. એ કામ તમે કરો.

જવાબમાં હું કહું છું, મારી પાછળ ગાંધીજીના માહાત્મ્યનું બળ હતું, એટલે તે વખતે એ મોટું કામ થાયું હવે એ સથિર થયેલી જોડણીમાં સુધારાને અવકાશ છે. પણ એને માટે પીઠબળ હવે સ્વરાજ્યના હિવસોમાં ગુજરાત સરકારનું તેમ જ ગુજરાતની તમામ યુનિવર્સિટીઓનું છે. એમાં એટલું જ ધ્યાન રાખવાનું કે સુધારો કરવા જતાં ફરી અરાજકતા દાખલ ન થાય. શુદ્ધિ મહત્વની છે, પણ સર્વમાન્ય સ્થિરતા એ જ સૌથી મહત્વની વસ્તુ છે.

*

ધર્મયુદ્ધના નિયમો

ગાંધીજીએ નાનીમોટી લડાઅીઓ લડવામાં જ જિંદગી ગાળી છે. લડવા સારુ જ તેમનો જન્મ છે, એમ કહીએ તોપણ ચાલે. અને છતાં તેમણે એક પણ માણસ સાથે વેર રાખ્યું નથી.

દક્ષિણ આફ્રિકામાં તેમનાથી વિરુદ્ધ વિચાર ધરાવનાર કેટલાક લોકોનું એક મંડળ જનરલ સ્મટ્રસને મળવા ગયું હતું. પોતાની વાત સ્મટ્રસના મન પર બરાબર ઠસાવવા જેટલું ભાશાનું જ્ઞાન અથવા કુશળતા તેમના કોઅનિનામાં ન હતાં. તેમણે ગાંધીજીને જ વિનંતી કરી કે, આપ અમારે ખાતર આટલું કામ કરી આપો. ગાંધીજીએ તે કામ કરી આપવાનું કબૂલ કર્યું અને એ લોકોને પૂરેપૂરો સંતોશ આપ્યો.

આ પ્રસંગમાં ગાંધીજીનું અજાતશત્રુપણું જેટલું જોવામાં આવે છે, તેટલી જ પોતાના વિરોધીના આ ગુણની કદર કરી તેના અનુપર સંપૂર્ણ વિશવાસ મૂકનાર પેલા ભાઅીઓની શરદ્ધા પણ તરી આવે છે. પોતાની ખેલદિલીથી ગાંધીજીએ કેટલાયે શત્રુને મિત્ર બનાવ્યા છે, કેટલાયે જ્ઞાને સજ્જનતાના પાઈ ભણાવ્યા છે, અને જ્યાં દ્વેશ ને છેતરપિંડીનું રાજ્ય હતું ત્યાં ધર્મયુદ્ધના નિયમોને માન્યતા અપાવી છે.

*

પેટ ભરાયું નહીં

મેં એક વાર બાપુજીને કહેવું : “આપની આત્મકથા એટલી બધી પારદર્શક, સત્યનિશ્ચ છે અને એમાં એટલા બધા વિવિધ રસો મળે છે કે વિશવસાહિત્યમાં એ જરૂર અંચું સ્થાન મેળવશે. અને છતાં એ ચોપડી વિશે મારા મનમાં ઘણો અસંતોશ છે. કેટલીયે સારી સારી વસ્તુઓ તે તે પ્રસંગે આપ અનુમતી શકત. તે નથી મળતી એટલે સરસ વાની ચાખી, પણ પેટ ભરાયું નહીં, એવું થાય છે એ આત્મકથા વાંચતાં.”

બાપુજીએ કહ્યું, “મારે મારી આખી આત્મકથા થોડી જ લખવી હતી ? મારા સત્યના પ્રયોગો પરતે જેટલું જરૂરી જણાયું તેટલું જ મેં એમાં આણ્યું છે. તમારી દુરુશટિએ એમાં જે ઔષધ છે, તે પૂરી કરવાનું કામ તમારું.”

[પદ્ધી યરવડા મંદિરમાંથી, બીજી જેલમાં રહેલા નાદુરસ્ત કાકા કાલેલકરને એમની તબિયત સુધારવા વિશે લખતાં 21-4-1933ના પત્રમાં ગાંધીજીએ કહેવું : “તમે ઘોડા જેવા થાયી જો અને ‘આત્મકથા’નો રહેલો ભાગ પૂરો કરજો. મારી પાસેથી આશા રાખવી, એ તો વેળું વલોવવા જેવું છે.”—સંપાદક]

ગાંધીજીના સત્યના પ્રયોગોનું બધાન વિશવસાહિત્યમાં પોતાનું સ્થાન લખી ચૂક્યું છે. એની શૈલી અનુપર દેશદેશાંતરના લોકો મુંઘ છે. અનેક સાધકોએ એમાંથી પેરણા મેળવેલી છે. છતાં કહેવું પડે છે કે એ ગંથથી આપણને પૂરતી ત્યુપ્તિ થતી નથી. સત્યનિશ્ચ ગાંધીજીએ જેટલું લખ્યું છે તેટલું તો બધું યથારથ જ છે. પણ એમની પાસેથી આપણે જે જે જાણવા માગીએ છીએ તે બધું એમાં આવ્યું જ છે એમ ન કહેવાય. જીવનનો આદરશ નક્કી કરતાં પહેલાં મનમાં જે ભવતિ-ન-ભવતિ ચાલે છે, જે મનોમંથન જીવનને પ્રકૃશુભ્ય કરી મૂકે છે, તેનું વર્ણાન એ આત્મકથામાં ક્રયાંય ન મળે. અમુક પ્રસંગ બન્યો એટલે મેં આમ નક્કી કર્યું, એમ ગાંધીજી લખી નાખે છે. એ નિર્ણય અપર આવતાં પહેલાં કેટલી બૌદ્ધિક વિટંબણાઓમાંથી પસાર થવું પડ્યું, કેટલા વિકલ્પો સેવવા પડ્યા અને છોડવા પડ્યા, એનો અનુલોખ ક્રયાંય જડતો નથી. અને નિર્ણય થયા પછી પણ શરીરને, ચિત્તબુર્તિને અને વાસનાઓને તે દિશા તરફ વાળતાં કેટલી મહેનત પડી, કેટલા ઘાટ ચઢવા પડ્યા, અને તેને માટે આત્મશક્તિ કેળવતાં હારજીતની કેટલી ભરતી-ઓટમાંથી પસાર થવું પડ્યું, એ બધું એમણે આણ્યું નથી. જાણે નિશ્ચય અને સિદ્ધાંત વચ્ચે કશું અંતર જ ન હતું. અને એમ જ થયું હોય તોયે આટલી જબરદસ્ત સંક્રલ્યશક્તિ કેળવવા માટે એમણે શું શું કર્યું, એ તો આપણને મળવું જોઅને.

ખ્રથમથી જ ગાંધીજી સાથે રહેલા અને ગાંધીજીની આખી જીવનપ્રેરણા સમજનારા કોઝી સાથીઓએ જો નિરીક્ષણ કરીને ગાંધીજીનું આંતરિક ચરિત્ર લખી આપ્યું હોત, તો એમની આત્મકથા પર પ્રકાશ પાડતું એ એક મહાભાષ્ય થયી જાત અને દુનિયાએ એવા વરંથને એમની આત્મકથા કરતાં પણ વધારે આવકાર આપ્યો હોત.

*

લોકોનાં હૈયાંમાં પેસવા

જીક અને લેટિન ભાષાઓએ યુરોપને એક કર્યું હતું. પણ એ ઐક્ષ્ય અનુપલા સ્તરના લોકોનું હતું. એ જ રીતે આ દેશમાં સંસ્કૃતે અનુપલા લોકોનું ઐક્ષ્ય સ્થાપ્યું હતું.

આ દેશમાં લોકભાષાના પહેલા પુરસ્કર્યતા હતા બુદ્ધ ભગવાન. એમણે કહ્યું કે, “મારે લોકોનાં હૈયાંમાં પેસીને લોકોમાં એક સર્વવસામાન્ય નૈતિક સ્તર નિરૂપાણ કરવો છે, તે હું સંસ્કૃત ભાષા મારફત ન કરી શકું. સંસ્કૃત અનુપલા લોકોની ભાષા છે. મારે જનતાની ભાષા જોઓએ છે.”

એમણે પાલી ભાષાની મદદ લીધી. “પલ્લી” એટલે જરામ. પાલી એટલે જરામભાષા. મહાવીરે પણ તેમ જ કર્યું. આ બન્ને કહેતા કે, અમે અનુપરના લોકો માટે આવ્યા નથી; લોકો માટે—જનતા માટે—અમારો જન્મ છે.

સંતોએ એ જ કામ આગળ ચલાવ્યું. તેઓ સંસ્કૃત શીખતા. જનાન મેળવતા સંસ્કૃત મારફત, પણ જનાનદાનનું કામ લોકભાષા મારફત કરવા માગતા હતા.

ગાંધીજી આ જ કામ હિન્દુસ્તાની મારફત કરવા માગતા હતા. હિન્દીવાળાઓએ હિન્દીમાં સંસ્કૃત શબ્દો અનહદ વધારી દીધા, હિન્દીને પંડિતોની ભાષા બનાવી. મુસલમાનોએ અનુરૂપે મુલ્લાંની ભાષા બનાવી. બંનેએ એક જ ધંધો ચલાવ્યો—સામાન્ય જનતાથી દૂર જવાનો. ગાંધીજી હતા જનતાના માણસ. એમણે બંને બાજુના લોકોને હિન્દુસ્તાની દ્રવારા જનતાભિમુખ બનાવવાનો પ્રયત્ન કર્યો.

*

કલમ દ્વારા કામ

સ્વરાજની હિલચાલ દરમિયાન ગાંધીજીએ પોતાની રચનાત્મક પ્રચુરતિઓ દ્વારા દેશને અને દુનિયાને ભારતીય સંસ્કૃતિના યુગાનુકૂલ નવા સ્વરૂપનું દર્શાન કરાવ્યું. એને અંગે અસંખ્ય લેખો લખ્યા. આજા દેશને અને દુનિયાને જે લખી આપવા જેવું એમની પાસે હતું તે એમણે પોતાનાં છાપાં મારફતે આપ્યું.

કરુમ્બીર ગાંધીજીએ અસંખ્ય લોકોને હજારો કાગળો લખ્યા છે. ઘણાખરા કાગળો બહુ ટૂંકા હતા; કેટલાક લાંબા લેખો જેવા મોટા હશે. એમને જે હજારો સાથીઓ મળ્યા તેમની સાથે—લગભગ દરેક સાથે—અંગત સંબંધ કેળવી તેમને ઘડવાનું કામ સંભાશણ દ્વારા, મુલાકાતો દ્વારા અને પત્રવ્યવહાર દ્વારા એમણે જે કર્યું, તેનો જોટો દુનિયામાં બીજે મળવો મુશ્કેલ છે. હું નથી માનતો કે માનવસેવાને અર્થે અનુત્તમોત્તમ કાર્યક્રતાઓ ઘડવાનું કામ કેળવણીકાર ગાંધીજીએ જેવી રીતે કર્યું તેવી રીતે અને તેટલું કામ કરનાર બીજો કોઝી મહાત્મા થયો હોય.

ગાંધીજીએ પોતાની કલમ દ્વારા એટલું જ મહત્ત્વનું ત્રીજું કામ કર્યું છે. પોતે સ્થાપેલી અથવા બીજાઓએ ચલાવેલી અસંખ્ય સંસ્થાઓ જોડે ગાંધીજીનો નિકટનો સંબંધ હતો. લગભગ દરેક સંસ્થા ચલાવનાર રાશટ્રરસેવક સલાહસૂચના અને પેરણા મેળવવા માટે ગાંધીજી પાસે આવ્યા વિના રહેવાનો જ નહીં. ગાંધીજી પણ પૂર્ણ આત્મીયભાવે બધી વાતો સાંભળી વિગતવાર સલાહ આપવાના જ; અને જરૂર પડ્યે તે તે સંસ્થાને ખાસ ઠરાવો ઘડવામાં મદદ કરવાના. આ રીતે કોરેસના અને બીજી અનેક સંસ્થાના અસંખ્ય ઠરાવો ઘડવામાં ગાંધીજીનો હાથ છે. ભવિશ્યની પરિસ્થિતિ અને આજે સહેજે ધ્યાનમાં ન આવી શકે એવી મુંજુવણોનો વિચાર કરી દૂરંદેશીથી એ બધાંને પહોંચી વળવા માટે ઠરાવોની સુંદર શાબ્દાવલિ ઘડવામાં ગાંધીજી એક્ફૂકા હતા.

*

જનહિતનાં કાર્યો કરતાં ગાંધીજીએ સાહિત્ય પાસેથી ઘણું કામ લીધું છે. સાહિત્ય એ સેવાનું સાધન છે; એ જેટલું શુદ્ધ, સંસ્કારી અને સમર્થ બનાવાય, તેટલી રાશ્ટ્રરની શકૃતિ વધવાની જ છે એમ તેઓ માને છે. સાહિત્યના ધુરંધરોને એમણે વીનવ્યા છે કે, તમારી શકૃતિનો પૂરેપૂરો લાભ હળ હંકનાર અને કોશ ચલાવનારા ગરીબ વર્ગને આપો, એમની સંસ્કારિતા એ જ તમારું સમાધાન હોય, એમનું ચારિત્ર્ય એ જ તમારી શકૃતિ હોય, અને એમની બુદ્ધિશકૃતિ એ જ તમારી કસોટી હોય.

સ્વરાજ્ય સરકારનો પણ આધાર નહીં

ગુજરાતની રાજકીય પરિશદ [1920માં] એક ઠરાવ કરી અમુક લોકોની સમિતિને આદેશ આપ્યો કે ગુજરાત માટે “સરકારથી સ્વતંત્ર એક રાશ્ટ્રીય વિદ્યાપીઠ”ની સ્થાપના કરે.

શ્રી નરહરિભાઓ, કિશોરલાલભાઓ અને હું ગુજરાતમાં બધે ફરયા. બે મહિનામાં બધું વાતાવરણ તૈયાર કર્યું. અને 18મી ઓક્ટોબરને દિવસે ગુજરાત વિદ્યાપીઠની પ્રભૂતિ બાપુજીના આશીર્વાદ સાથે શરૂ કરી.

ગાંધીજીએ આ વિદ્યાપીઠને જે સિદ્ધાંતો આપ્યા, એમાંનો બીજો સિદ્ધાંત નીચલા શબ્દોમાં એમજો મૂકેલો :

“વિદ્યાપીઠ તરફથી ચાલતી તથા તેણે માન્ય કરલી પ્રત્યેક સંસ્થા અસહકારી હશે. અને તેથી સરકારનો કોઓ પણ પ્રકારનો આશરય નહીં લખી શકે.”

આ સિદ્ધાંત ગાંધીજીએ આપ્યો ત્યારે આ દેશ અનુપર અંગેજોનું રાજ્ય હતું. અને એ વિદેશી સરકાર સામે, ગાંધીજીની પ્રેરણાથી, દેશે અસહકાર પોકાર્યો હતો. સ્વરાજ્ય થયું એટલે ગાંધીજીના જ સાથીઓના હાથમાં રાજ આવ્યું. પછી અસહકારનો કશો અરથ રહ્યો નથી, માટે વિદ્યાપીઠના નેતાઓએ આ કલમ કાઢી નાખી એ સ્વાભાવિક છે. અને યથાકાળે એ જ સ્વરાજ્ય-સરકારના નેતાઓએ ગુજરાત વિદ્યાપીઠ જેવી અનેક રાશ્ટ્રીય સંસ્થાઓને માન્યતા આપી, અનુદાનો આપ્યાં, એ બધું યથાયોગ્ય થયું છે.

અને છતાં ગાંધીજીની નીતિ નોખી હતી, એ વસ્તુ તરફ ધ્યાન ભેંચવું મારું કરૂતવ્ય સમજું છું. વિદ્યાપીઠનાં ધ્યેયો ગાંધીજી પાસેથી સ્વીકારતાં એમની સાથે મેં જે ચર્ચા કરી હતી અને એમની પાસેથી જે સ્પશ્ટતા મેળવી હતી, તે અહીં નોંધું છું.

મેં ગાંધીજીને કહ્યું કે, “ભારતની સંસ્કૃતિ, ભારતની સામાજિક-આર્થિક પરિસ્થિતિ, બધાંનો વિચાર કરી આપે આ બાર સૂત્રો આપ્યાં છે. પણ તેમાંનું આ અસહકારનું સૂત્ર, અસહકારના કાળ પૂરતું જ હોઅની, બીજાં સૂત્રોની પેઠે એ પૂરતું વ્યાપક નથી.”

તે વખતે ગંભીર થાંડી ગાંધીજીએ કહ્યું : “અસહકારની વાત આ સૂત્રમાં મેં ચાલુ નીતિ પૂરતી જ મૂકેલી છે, એ વાત ખરી છે. પણ તમે જાણો છો કે જે અહિસક સંસ્કૃતિ આપણા દેશમાં આપણે ચલાવવા માણીએ છીએ, તેમાં સરકારનું કામ જેટલું ઓછું કરી શકાય તેટલું કરવું. સ્વરાજ્યમાં પણ આપણે સરકાર નામની સંસ્થા અનુપર જેટલો ઓછો આધાર રખાય તેટલો સારો. તેથી સ્વરાજ્યના દિવસોમાં પણ આપણી કેટલીક સંસ્થાઓ

સરકારનો આધાર ન લે, એ જ આપણે ખિચીએ છીએ..”

વાત ટૂંકાવવા માટે મેં અમેર્યં હતું કે, “આપ ખિચો છો કે સ્વરાજ્યના હિવસોમાં પણ કેળવણી જેવી જીવતી રાશ્ટ્રીય સંસ્થા સરકારનો આશરય ન શોધે, એ જ અનુત્તમ છે..”

બાપુજીએ કહ્યું, “અંગરેજોનું રાજ્ય હટાવી જે સ્વરાજ્ય સ્થપાશે, તે પણ આપણે ખિચીએ એવું ન હોય. એની પાસેથી કામ ઓછામાં ઓછું લખીએ, અને કાંઈ નહીં તો આપણી વિદ્યાપીઠ સરકારને આધારે નહીં જ ચાલે. સત્ય અને અહિંસામાં માનનાર લોકો સરકાર અનુપર આધાર રાખવાનું જરાય પસંદ ન કરે. સરકારો કેવી હોય છે એ વિશેનો મારો અભિપ્રાય ‘હિંદ સ્વરાજ’માં મેં આપ્યો છે, તે તમે જાણો છો..”

મેં કહ્યું, “વિદેશી સરકાર માટે નહીં પણ તમામ સરકારો માટે તમે ત્યાં આકરામાં આકરા શબ્દો વાપર્યા છે...”

બાપુજીએ વચ્ચમાં જ કહ્યું, “સરકાર આજે એક પદ્ધશના હાથમાં હશે, કાલે બીજા પદ્ધશના. અને કોઝી પણ સરકાર નૈતિક ચારિત્ર્ય વધારનારું કામ સ્વેચ્છાએ કરતી નથી. દેશમાં વાતાવરણ તૈયાર થયી જાય, એટલે લોકોના દબાણને વશ થયી સરકાર એને કાયદાનું સમર્થન આપે છે, એટલું જ. તેથી હું ખિચું છું કે, સ્વરાજ્ય થયા પછી અસહકારની નીતિ રહેશે નહીં. છતાં તમારા જેવા આ સંસ્થાને સરકાર-આધારિત નહીં જ બનાવો, એની મને ખાતરી છે. આદર્શ રાશ્ટ્રરસેવકો તૈયાર કરનાર વિદ્યાપીઠ સરકારની આશરિત ન જ થવી જોખીએ..”

બાપુજી જોડે જે વાતચીત થયી હતી, તે જ અહીં મેં મારા શબ્દોમાં મૂકી છે.

શરૂઆતમાં સરકાર પાસેથી આપણે માન્યતા મેળવીએ ત્યારે સરકાર અનુદાન આપે, અને છતાં વિદ્યાપીઠ અનુપર કાબૂ ચલાવવાનો પ્રયત્ન સરકાર નહીં કરે. સરકાર ચતુર હોય છે. ગુજરાત વિદ્યાપીઠ જેવી ગાંધીજીની તેજસ્વી સંસ્થા સરકાર પાસેથી માન્યતા મેળવવા અરજી કરે, એટલું સરકારને આજે બસ છે. ચોટલી હાથમાં આવે તોયે એ ચોટલી ખેંચે નહીં, એટલી ચતુરાચી સરકાર પાસે છે.

આગળ જતાં જ્યારે સરકારની માન્યતાને જોરે વિદ્યાપીઠના સ્નાતકોને સારી સારી નોકરીઓ મળશે, સરકારનાં અનુદાનોની મદદથી સંસ્થાએ પોતાનો વિસ્તાર વધાર્યો હશે, ત્યારે જનતા પણ માનશે કે સરકારની મદદથી કામનો આવડો મોટો વિસ્તાર થયો છે, એટલે સરકારની આણ કબૂલ રાખવામાં ડહાપણ છે. આગળ જતાં સંસ્થાની અનુયોગિતા વધશે. પણ તેજસ્વિતા અને ફ્રાંતિકારિતા ટકશે, એની ખાતરી શી? માટે હું કહું છું કે આજે સરકારના ઘરમાં આપણી પ્રતિશ્ઠા અનુત્તમ હોય તોયે, એને આધારે આપણે જીવીએ

એમાં જોખમ છે. આપણી આવકનો મોટો ભાગ જનતા પાસેથી જ આપણે મેળવવો જોઓઓ. જનતા આગળ આપણી પ્રતિશઠા કાયમ રહે, એ મુખ્ય વાત છે.

અને ગાંધીજીના વિચારો જાણતો હોવાથી હું ભારપૂરવક કહીશ કે સરકારના અનુદાન અુપર આપણે આધાર રાખતા થયા, તો સરકાર અુપર કાબૂ રાખવાની આપણી ફરાંતિકારી મહત્વાકંઈકા છોડી જ દેવી પડશે. રાજ્યસત્તા કે ધર્મસત્તા કરી ન શકે તે સાંસ્કૃતિક કામ તેજસ્વીપણે ચલાવવા માટે, અને આપણી ફરાંતિકારિતા ટકાવવા માટે, આપણે કોક દિવસે સરકારથી સ્વતંત્ર થયે જ ધૂટકો. આકરામાં આકરી સ્થિતિમાં પણ પ્રજાનો અંતિમ આધાર વિદ્યાપીઠ જેવી રચનાત્મક ફરાંતિકારી સંસ્થા જ છે, એ જાતનો વિશ્વાસ પ્રજામાં જાગરત રહેવો જોઓઓ. રાશ્ટ્રરહિતનો બધી બાજુથી વિચાર કરનાર ચિંતકો અને રાશ્ટ્રરહિતની મહત્વાની પ્રયુક્તિઓ ચલાવનાર સેવકો એ જ સમાજ માટે અંતિમ આધાર છે, એમ સમજી જાહેર જીવન સરકાર-આશરિત ન રહે એ જોવાનું કામ આપણું છે. અને એ કામ વિદ્યાપીઠ જેવી સંસ્થાઓ જ કરી શકશે.

*

હુરુદ્યની વિશાળતા

ગાંધીજીની ધર્મદ્વારાથી લોકોના દોષો જોવાની બનતાં સુધી ના જ પાડે છે. અને જ્યારે તે જુએ ત્યારે પણ, માણસના દોષો એ જ એના જીવનનું સ્થાયી અંગ છે એમ માનવાની પણ ના પાડે છે. હુરુદ્યની વિશાળતાથી તેઓ બધાનો સ્વીકાર કરે છે, મારો તેને મદદ આપી છૂટે છે, અને કોઓના કામમાં માથું મારતા નથી. પોતાના કામમાં પોતાની શરતે ગમે તેનો સહકાર સ્વીકારવા તત્પર રહે છે, અને પરિણામ અશીવરના હાથમાં સુરક્ષિત છે એવી શરૂઆથી હમેશા ચાલે છે.

અને પરિણામ એટલે શું? સમાજનું હુરુદ્ય કંબીક અનુનત થાય, રાશ્ટ્રરીય જીવન તેજસ્વી થાય, સત્યનું વધારે સ્પર્શ દર્શાન થાય, અને શુદ્ધધ હુરુદ્યનો વિજય થાય, એટલું જ માણસ અન્યથી શકે. એ પરિણામમાં ગાંધીજી કોણે હાર્યા નથી.

*

ફેરફાર એક બાબતમાં—

બાપુજી જ્યારે જ્યારે ખાઈની વાત કરતા ત્યારે હું જાણતો હતો કે પ્રજાજીવનને નિયોવીને અમુક લોકો આગળ આવે એ વસ્તુનો વિરોધ કરવો છે. પણ મને લાગતું હતું કે બાપુજી પોતાની શરહ્દા આપર અધિક ભાર મૂકે છે. દેશ એ જીલી ન શકે. પણ મારે મન એ વસ્તુ ગૌણ હતી.

પણ હું અસ્વસ્થ થયો એ દિવસે જ્યારે બાપુજીએ એક મોટું જાણે સૂત્ર મૂક્યું : “રાશ્ટ્રરીયશાળા એટલે રેટિયાશાળા”. રાશ્ટ્રરીય કેળવણીમાં ખાઈને મહત્ત્વ આપવા હું તૈયાર હતો. રાશ્ટ્રરીય કેળવણીમાં રૂમને મહત્ત્વનું સ્થાન હોય, એના વગર શોશેષથી મુક્ત એવા સમાજની સ્થાપના થથી ન શકે, એ વસ્તુ રાશ્ટ્રરને ગળે અનુતારવાનો મારો પ્રયત્ન બરાબર ચાલતો હતો. પણ રાશ્ટ્રરીય શાળા એટલે રાશ્ટ્રરની આત્મજાગ્રત્તિની શાળા, ચૈતન્યમય સંસ્કૃતિના વિકાસની શાળા, એવા એવા પેરણાદાયી શબ્દો હું વાપરતો હતો. ત્યાં બાપુજીએ રાશ્ટ્રરીયશાળા એટલે રેટિયાશાળા એ સૂત્ર મૂકીને મને આઘાત પહોંચાડ્યું. ફેરફાર એક બાબતમાં બાપુજીની પેરણા સમયાનુકૂલ નથી, એમ મને લાગવા માંડ્યું.

*

વિરોધવૃત્તિ છીનવી લેનાર

ગાંધીજીની વિશેશતા એ છે કે તેઓ વિરોધીઓ પાસેથી તેમની વિરોધવૃત્તિ છીનવી લે છે. જેની સાથે તેમનો વિરોધ હોય, તેની સાથે ઘટે તે કરતાં પણ વધુ પદ્ધતિપાત તેઓ પહેલેથી જ બતાવી દે છે. પોતાના વિરોધીઓને પોતાના જ જેવા સજ્જન અને બહાદુર માની લે છે. દરેક માણસનું હુરુદ્ય સ્વાર્થ, અભિમાન, અિરૂશ્યાથી ભરપૂર હોય છે; બિચારી ધર્મબુદ્ધિ એક ખૂણામાં દબાઓ રહે છે. પોતાની અદારતાથી ગાંધીજી એ ધર્મબુદ્ધિને જાગરત કરે છે; અને પછી વિરોધીઓના ઘરમાં પણ સ્વાર્થ, ફરોધ આદિ રિપુઓ અને ધર્મબુદ્ધિ વચ્ચે સંગ્રામ શરૂ થાય છે. યુદ્ધશાસ્ત્રવિશારદો કહે છે કે રણસ્તંભ તો વિરોધીઓના ફરોધમાં જ રોપાવો જોણીએ. ગાંધીજીએ આ નિયમનું સંપૂર્ણ પાલન કર્યું છે.

*

નમ્રતાનો અવતાર

ગાંધીજીમાં સિદ્ધ્યાંતનિશ્ઠાની પરાકાશઠા હતી, આત્મવિશવાસના તો તેઓ મેરુ જ હતા. સાથેસાથે એટલી જ અસાધારણ નમ્રતા પણ તેમનામાં હતી. નમ્રતા એમના બોલવાચાલવામાં ડગલે ને પગલે દેખાઓ આવતી દાદાભાઓ નૌરોજી જેવા કોઓ કુદ્દધ રાશ્ટ્રપુરુષની આગળ તેઓ સ્વાભાવિક રીતે જેટલા નમ્ર દેખાતા. એટલા જ નમ્ર તેઓ પોતાના સહકારીઓ સાથે સમાનતાથી વર્સ્ટતા ત્યારે પણ દેખાતા. રવીન્દ્રનાથ આગળ તેઓ કેટલા નમ્ર દેખાતા ! નમ્રતાને અવતાર લેવાનું મન થયું અને તે એમને રૂપે અવતરી, એમ જ કહેવાનું મન થાય.

પણ નમ્રતા વિશે એમના વિચારો વિલક્ષણ જ હતા. તેઓ કહેતા કે બીજા સદ્ગુણોની જેમ નમ્રતાનું અનુશીલન થાયું શકે નહિ. નમ્રતા કેળવવાનો કોઓ ઘ્યતન કરવા જાય, તો તેનામાં ફુરુતરિમતા આવે. એક વાર એમણે મને કહ્યાયું : “મારી અંમર પચાસ વરસની હોય ત્યારે હું નમ્રતાથી શું એમ કહું કે એ પિત્સાળીસ વરસની છે ?”

ગાંધીજીમાં ચારિત્ર્યનું તેજ હતું, અને કસોટીની વેળાએ ઘ્યતની પરાકાશઠા કરવાનો દ્રુઢ નિશ્ચય પણ હતો. જે સત્યનિશ્ઠ હોય તેને પોતાના જ્ઞાનનું, ચારિત્ર્યનું કે આત્મવિશવાસનું અભિમાન નથી હોતું. મોટા મોટા વીરો જ્યાં કસોટીને ઘરસંગે કાચા નીવડે છે, ત્યાં કસોટીની વેળાએ આપણું જ્ઞાન, ચારિત્ર્ય અથવા આપણો આત્મવિશવાસ ક્રયાં જશે, કોને ખબર ! — એમ એ વિચાર કરે છે, અને પ્રારૂથના કરે છે કે, હે ભગવાન ! મારી કસોટી થાય ત્યારે તું જ મને બળ દેજે !

આ હતી ગાંધીજીની નમ્રતા.

*

ચારિત્ર્ય-નિરૂપમાણની પ્રયોગશાળા

મનુશયના સામાજિક જીવનના પ્રારંભમાં જ કુદરતે પતિ-પત્ની અને બાળકોના સંગઠનને પ્રધાનતા આપી કુટુંબની સ્થાપના કરી છે. આવાં અનેક કુટુંબો એકત્ર આવીને પરસ્પર સહકાર્ય કરવા લાગ્યાં, ત્યારે જાતિઓ નિરૂપમાણ થયી. હવે વ્યાપક સંગઠનની જરૂર અસ્તિત્વના થયી છે. જાતિ-ભેદ, ભાષા-ભેદ, ધરૂમ-ભેદ અને આહાર-ભેદ હોવા છતાં કેટલાંક કુટુંબોએ સહજીવનના પ્રયોગો કરવા જોઈએ.

સંસ્કૃતિના જેટલા પ્રયોગો આ દેશમાં થયા, તે બધા આશરમો દ્વારા થયા છે. રવીન્દ્રનાથનું શાંતિનિકેતન પ્રથમ “બ્રહ્મમચર્યાશરમ” હતો. સ્વામી શરદ્ધાનંદે આર્ય સંસ્કૃતિના અધ્યયન માટે ગંગાકિનારે એક ગુરુકુળની સ્થાપના કરી. એમનું અનુકરણ કરીને અનેક લોકોએ જુદે જુદે સ્થળે આચાર્યકુળો સ્થાપ્યાં. વિવેકાનંદે જે અદ્વૈતાશરમ સ્થાપ્યો, તેમાંથી દેશમાં અનેક સેવાશરમો જન્મ્યા. શ્રી અરવિંદે પણ એક આશરમ ચલાવ્યો. ગાંધીજીએ અન્યાયનો પરતિકાર કરનારા સત્યાગ્રહ જેવી આધ્યાત્મિક શકૃતિનો વિકાસ આશરમ દ્વારા કર્યો. આ દેશમાં જેને જેને કાંચીક નક્કર કામ કરવાનું મન થયું, તેણે પોતાનો આશરમ ચલાવ્યો જ છે. આ [બધી] સંસ્થાઓએ દેશને અનેક અધ્યાપકો અને વિદ્વાનો આપ્યા છે. દેશમાં સામાજિક ફરાંતિ કરવા અન્યાનારા કાર્યકર્તાઓને આશરમજીવનના નવા પ્રયોગો કરવાની આવશ્યકતા ધ્યાનમાં આવ્યા વગર રહેવાની નથી.

ગાંધીજીના સત્યાગ્રહાશરમના પ્રયોગને લીધી આખા દેશમાં ચારિત્ર્યની અનુનતિનું એક અજૂજીવળ વાતાવરણ નિરૂપમાણ થયું હતું. આશરમ મારફત એમણે વ્યક્તિગત, કૌટુંબિક, સામાજિક જીવનનો એક અંચો આદરશ દેશ આગળ મુક્ક્યો હતો. એનું ધ્યાન કરીને ભારતમાં ચારિત્ર્યની સર્વવાંંગી અનુનતિ થવા લાગી હતી.

આજે જ્યારે દેશમાં સંકુચિતતા, સ્વારૂપ, સત્તાલોભ, પક્ષશાબ્દિમાન વગેરે અસામાજિક દોશો બધી ફેલાયેલા જોઓએ છીએ ત્યારે, ગાંધીજીએ આશરમ મારફતે ચારિત્ર્યશુદ્ધિ અને જીવનશુદ્ધિનો જે પ્રભાવ બતાવી આપ્યો હતો એનું મહત્ત્વ નજરમાં વિશેશો કરીને આવે છે. ગાંધીજી કહેતા કે, આશરમ મારી સહૃથી અસ્તમ કરુંની છે.

આજે દેશની ભૌતિક પ્રગતિ થતી જાય છે, પણ ચારિત્ર્યનો નાશ થયો છે. અને ચારિત્ર્ય વિશે નિરૂપવીર્ય વ્યાખ્યાનો આપવામાં નેતાઓ પોતાની વાણીનો અવિકંશ અસ્પષ્યોગ કરે છે. પણ વ્યાખ્યાનોથી ચારિત્ર્ય નિરૂપમાણ થવાનું નથી, અને કડક શિક્ષણ કરવાથી પણ થવાનું નથી. તેને માટે રચનાત્મક કાર્યકર્મ જોઓએ. એ જ હતો આશરમજીવનનો હેતુ.

હવે પછી જે નવા આશરમો સ્થપાય એમણે ગાંધીજીના આ પર્યોગનું તરસ્થપણે ચિંતન કરી, નવી પદ્ધતિના પર્યોગો કરવા જોઅઓ. ગાંધીજીના પર્યોગની જે મોટી ઔણપ મને લાગે છે તે એ કે એનું વાતાવરણ મુખ્યત્વે હિન્દુ હતું. વિશેરો કરીને હિન્દુઓ જ ત્યાં આવ્યા બીજા ધર્મભીઓને આશરમ આકર્ષિત ન કરી શક્યો. એ યશ ઓછાવત્તા પરમાણમાં થિયોસોફ્ઝિસ્ટોને અને શરી અરવિંદને મળ્યો. હવે જે આશરમો આપણે ચલાવવા જોઅઓ એનું વાતાવરણ બૌદ્ધ, ખરિસ્ટી, મુસલમાન અને વિદેશી લોકોને પણ આકર્ષિત કરી શકે એવું અનુભાવ હોવું જોઅઓ. બધા ધર્મો વિશે સદ્ગ્રામ કેળવી, માત્ર એને પોશક એવી આધ્યાત્મિકતાનો જ આગરહ આપણા આશરમમાં રાખવો. કોઅની પણ વિશેરે ધર્મની જૌણ વાતોને આપણા આશરમમાં સ્થાન ન હોય.

*

દર દસ માઝીલે આશરમ

હિંદના ઐતિહાસનું અધ્યયન કરું છું, તેમાં હું જોઅનું છું કે સાધુસંતોએ પગપાળા ઘવાસો કરીને ભગવાનનો દ્યાદાનનો સંદેશો ઘેરઘેર ફેલાવીને જેટલી રાશ્ટ્રસેવા કરી છે, તેટલી બીજા કોઅઓ કરી નથી. યુરોપ, ચીન, આપાન જેવા વિદેશોમાં પણ પરજાનું ચારિત્ર્ય ઘડનારા સાધુસંતો જ થએ ગયા છે.

એ જ જૂના સંતોની કાર્યપદ્ધતિમાં આપણે સેવાભાવનાનો અનુમરો કરીએ છીએ. આપણે જૂના વિચારો બદલીને નવા લઅશીશું, પણ નિશ્ચા તો જૂના જેવી જ હોવી જોઅઓ.

જ્ઞાનસેવકો ગામડામાં બેસે તેમણે સમગ્ર દૂરુશટિએ કામ કરવાનું છે. આપણે એવી લાયકાત કેળવવી જોઅઓ કે લોકોને તેમના તમામ પરશ્નોમાં યોગ્ય દોરવણી આપી શકીએ.

આવી લાયકાત મેળવવા માટે જ્ઞાનસેવકોને યોગ્ય કેળવણી મળવી જોઅઓ. એવા રાશ્ટ્રસેવકો તૈયાર કરવા ખાતર જ ગાંધીજીએ સાબરમતીમાં આશરમ કાઢ્યો હતો. આજે આવા ચારિત્ર્યવાન સેવકો તૈયાર કરવા માટે આશરમોની જરૂર છે. દર દસ માઝીલે આવા આશરમો હોવા જોઅઓ. તો જ આપણું સ્વરાજ ટકવાનું છે.

*

એકલો

સત્યનો અનન્ય અનુપાસક એકલો જ હોણી શકે. દ્રુષ્ટિણ આફ્રિકામાં એક વાર એક ગોરો ગાંધીજીને મળવા આવ્યો. બોલ્યો : ‘મિસ્ટર ગાંધી, હું તમારો એક પ્રશંસક છું—‘છું’ કહેવા કરતાં ‘હતો’ કહેવું જોઓએ. મારા મનમાં તમારે માટે અસીમ ભક્તિ હતી. હવે તે રહી નથી. તમને હું એક મહાન આધ્યાત્મિક પુરુષ માનતો હતો. અને મારો દ્રુઢ મત છે કે જેના જીવનમાં શુદ્ધ અધ્યાત્મ હોય છે, એને લોકો માનતા નથી હોતા. એમને વિશે અનેક ગેરસમજ ફેલાય છે અને તેને એકલા પોતાને રસ્તે જવું પડે છે. તમે આજ સુધી તેવા હતા, પણ હવે નથી. આજે અનેક લોકો તમારી પાછળ ચાલવા લાગ્યા છે. તમે કહો છો તે લોકો માને છે. આ અધરથી મને લાગવા મંડ્યું છે કે હવે તમારી પાસે શુદ્ધ સત્ય નથી. એમાં ‘વહેવાર’ પણ થોડોક બેળાયો હોવો જોઓએ. તે ગમે તેમ હો; તમને દુનિયામાં યશ મળતો રહેશે, પણ મારી ભક્તિ મળવાની નથી.’’

ગાંધીજીએ જેમની એકનિરણથી અખંડ સેવા કરી, તેમાંથી કેટલા લોકો છેલ્લે છેલ્લે એમનું કહેવું માનવા તૈયાર હતા ? ગાંધીજીનો યશ જોઓને ગાંધીજી પરની પોતાની ભક્તિ નશટ થાયી, એવું કહેનારો પેલો ગોરો જીવતો હોત તો ગાંધીજીના છેલ્લા દિવસો જોઓ એઝો અવશ્ય કહ્યું હોત કે ક્રોસ પર ચડનારા યેશૂનો જ આ આધુનિક અવતાર છે.

*

જરૂર કવિ ગટેએ કહ્યું છે કે, વિભૂતિમાન પુરુશો કોઓના મિત્ર થાયી શકતા નથી. એમની સાથે સંબંધમાં આવ્યા હોય એ લોકો વિભૂતિમાન પુરુશ પરતે વજાદારી અવશ્ય કેળવે, પણ એ લોકો જો તે વજાદારીના બદલામાં સામેથી વજાદારી માગે તો તેઓ ભૂલ કરે છે.

ગાંધીજી કહે છે કે સાચો મોક્ષશાર્થી માણસ કોઓનો જ મિત્ર ન થાયી શકે, અથવા આખા જગત સાથે એની મૈત્રી હોય છે.

*

શરદ્ધાનું પ્રતિબિંબ

મનુશયપ્રાણીએ કેટલોયે અન્યાય કર્યો હોય અને કેટલાંયે પાપ કર્યાં હોય,
તોપણ મનુશ્ય એ મનુશ્ય છે; તેને આખરે ધર્મનો રસ્તો સૂજશે જ,
એવી ગાંધીજીની અમર શરદ્ધા છે.

એ શરદ્ધાથી જ તેઓ બધું સહન કરે છે,
અને સહન કરીને પોતાની શરદ્ધા બીજમાં રેતે છે.

તેમનું બાળક જેવું નિરૂમણ મુક્ત હાસ્ય અભિની એ શરદ્ધાનું જ પ્રતિબિંબ છે.
લોકવારૂતામાં જે વરૂણન આવે છે કે
પવિત્ર પુરુષોના હાસ્ય સાથે પુશ્પ અને મોતીના પોશ જરે છે,
તે ગાંધીજીના હાસ્યમાં ચરિતારૂથ થયું છે.

કેટલાક પાસે વિશવવિજ્યી તલવાર હોય છે,
કેટલાક પાસે વિશવમોહિની ચતુરાઓ હોય છે, કેટલાક પાસે વિશવવશી રૂપ હોય છે,
કેટલાક પાસે વિશવભયંકરી સત્તા હોય છે. ગાંધીજી પાસે આમાંનું એકે નથી..

તેમની પાસે ફક્ત વિશવર્ષેમી હાસ્ય છે—
અને તે એક હાસ્યની અંદર બધી શક્કતિઓ સમાયેલી છે.
આ પવિત્ર હાસ્યે ચોર-લૂટારા અને ખૂની લોકોને
સમાજના હિતેચુ બનાવ્યા છે, ધૂરૂતોને લજ્જિત કર્યા છે,
પારકાંને પોતીકાં બનાવ્યાં છે, બગડેલાંઓને સુધાર્યાં છે,
કટ્ટર વિરોધીઓને દિલોજન દોસ્ત બનાવ્યા છે.

*

આજના કાળમાં ગાંધી

ગાંધીજીની અસર નીચે જેમણે કામ કર્યું છે તેમાંના જ કેટલાક લોકો પૂછવા લાગ્યા છે કે, ગાંધીજીએ જે કાર્યક્રમ ચલાવ્યો હતો તેમાંનું આજે કેટલું ચલાવવા જેવું છે ?

તો, ગાંધીજીએ જે કાર્યક્રમ ચલાવ્યા તે જ આજે તેમના તેમ ચલાવવા જોઓએ એવું નથી. એમાં પરિવર્સ્તન કરી શકાય. કાળ બદલાયો છે.

પણ જેને “આજ” કહો છો, તે કાળનું વૈશિષ્ટ્ય શું છે ? ગાંધીજીએ પોતાનાં બધાં કામોમાં સત્યનો આગરહ રાજ્યો. સત્યથી મોટી બીજી કોઓ જ વસ્તુ નથી, એમ તેઓ કહેતા. [હવે] તમારું શું એમ કહેવું છે કે ગાંધીજીના સમયમાં સત્યનું પાલન આશીર્વાદ હતું, પણ આજે અનિશ્ચિત છે ? અસત્ય ચલાવીને જ આગળ જવું જોઓએ, એમ “આજ”ના કાળનું કહેવું તો નથી ને ? અન્યાય વિરુદ્ધ લડવું, એ ગાંધીજીના સમયમાં ચાલ્યું. [તો] આજે એ ચાલવાનું નથી કે શું ? કેટલાક ડાહ્યા લોકો પૂછે છે કે ખાઈનો તમારો આગરહ હજી પણ છે ? હું કહું છું કે બધાને કામ આપવા સરકાર બંધાયેલી છે. ખાઈને બાજુએ રાખીને સરકાર બધાને કામ આપી શકે એમ હોય, તો આપણે ખાઈ જરૂર છોડી શકીએ.

*

સ્તુતિ નહીં, અનુકરણ

આપણા દેશમાં કોણી પણ માણસમાં સહેજ પણ ચમકારો દેખાય કે તરત એને માટે ભક્તિની ભાશા વાપરી લોકો એને અવતારી પુરુશ બનાવી દે છે. અને એ માણસ જો આખા સમાજ અધ્યર અસર પાડનારો હોય, તો તો પૂછવું જ શું? એને અવતારી પુરુશ તરીકે જાહેર કરી, એણે કરેલા અથવા ન કરેલા ચમત્કારોનાં વર્ણણન આગળ એનું સાચું જીવન ઢંકાઓ જાય છે. બીજા લોકોની વાત તો છોડી દયું. આશરમનાં અમારાં અનુત્તમ સાથી પ્રેમાબહેન કંટકે ‘મહાભારત અધ્યર એક મુક્તચિંતન’ લખ્યું છે. અને એને માટે એમણે અમારા જ આશરમના પ્રમુખ સાથી વિનોબા ભાવેની પ્રસ્તાવના લીધી છે. ચોપડીમાં પ્રેમાબહેન શરીરકુશણનું ચરિત્ર અપસ્થિત કરવાનો સરસ પ્રયત્ન કર્યો છે. એને અંગે વિનોબા લખે છે :

“પ્રેમાબાઓએ ગાંધીજીની પણ અવતારમાં ગણના કરી છે તે જોઓને, મહાત્માજી અધ્યર એમ કહેવાનો પ્રસંગ આવવાનો કે ‘ભગવાન મારા મિત્રોથી મને બચાવો.’ ગાંધીજીના આખા જીવનમાં એકુકે અમાનવીય ચમત્કાર બનેલો નથી.”

મેં તો અનેક વાર કહ્યું છે કે અમે ગાંધીજીના પ્રસંગમાં આવ્યા, એટલે પોકારીને કહીશું કે મહાત્માજી માણસ જેવા માણસ હતા. એમનામાં માણસની નાની નાની ઔણપો પણ હતી. પણ અંડ જાગૃત જીવનસાધન દ્વારા તેઓ શરેષ્ઠ પુરુશ થયા. અને આખી દુનિયાએ એમને ‘મહાત્મા’ તરીકે ઓળખ્યા.

આપણી કલ્યાનાના અવતાર તો પૂર્ણપુરુશ પરમાત્મા. માનવના અદ્વધારને અર્દ્યે મનુશ્યરૂપ ધારણ કરીને પોતાની લીલા ચલાવે છે. પણ બેઠેખર એ દૈવિકશક્તિ માનવનું રૂપ ધારણ કરી લીલા ચલાવે છે. સામાન્ય માનવો એમના જીવનમાંથી અનુકરણ કરવા જેવું શોધવાની હિંમત શી રીતે કરી શકે?

ગાંધીજી એવા ‘આવેલા’ પુરુશ ન હતા કે જેમનું અનુકરણ કરાય જ નહીં. ગાંધીજી પોતે માનવ હોયી, “સામાન્ય માનવ પણ સેવા કરતાં કરતાં, ધારે તો કેટલો ઝૂંચો ચડી શકે છે” એનો એક અનુત્તમ ધાખલો એમણે રજૂ કર્યો છે.

સનાતની હિંદુ ધર્મમાં અવતારની કલ્યાન છે. એની સામે બૌદ્ધધો કહે છે : કોઓ પણ જીવ સંકલ્ય કરે કે, મારે બુદ્ધ થવું છે, બુદ્ધચત્વની બધી સાધના હું કરતો જઈશ. પછી એ બુદ્ધચત્વ પ્રાપ્ત કરવા માટે જુદા જુદા ગુણો કેળેવે છે. એ ગુણોનો પરિપૂર્ણ અનુકરણ થાય એટલે એ બુદ્ધ થાય છે. આ રીતે કોઓ પણ સામાન્ય જીવ જો સંકલ્ય કરે, અને

તે ખમાણો તપસ્યા કરે, તો એ જરૂર બુદ્ધિ થવાનો જ.

આ આદર્શ તમામ માનવો આગળ રાખવા જેવો છે.

ગાંધીજીને અવતારી પુરુષ કહીએ, તો તેઓ અનુકરણથી પર બને છે. જો આપણો એમને મહાત્મા કહીએ, તો એમનું જીવન માણસ માટે અનુકરણ કરવા જેવું હોય છે.

ગાંધીજી અનેક વાર સાથીઓને કહેતા કે, “મારામાં જો કોઓ સારાપણું તમે જુઓ તો મારી સ્તુતિ કરવા નહીં બેસતા : મારું અનુકરણ કરો.”

*

‘અફ્શર’થી ‘હિંસા’ સુધીના ફક્કાવાર ગોઠવેલા અંશી જેટલા વિશયો પરના ગાંધીજીના વિચારો એમની ભાશામાં રજૂ કરતી પુસ્તિકા

‘ગાંધીના કન્ખ-ગ’માંથી નીચેના નમૂના અનુકરણ આપોયો છે.

સંપાદક : મહેન્દ્ર મેઘાણી. પાનાં 48 : રૂ 4 [લોકમિલાપ]

100 નકલના રૂ. 300 : 1,000 નકલના રૂ. 2,500

સ્વરાજ

મારે મન સ્વરાજ એટલે

દેશના અત્યમાં અત્ય બંધુને માટે સ્વતંત્રતા.

અંગેજની ઝૂંસરીમાંથી જ હિંદુસ્તાનને બચાવવામાં મને રસ નથી.

મારી તો હિંદુસ્તાનને કોઓ પણ ઝૂંસરીમાંથી બચાવવાની ટેક છે.

ભૂત કાઢીને પલિત સ્થાપવાની મારી જરાયે બિચછા નથી..

એટલે જ મારે માટે તો

સ્વરાજની ખૂબુતી એ આત્મશુદ્ધિની ખૂબુતી છે.

સત્યને, એટલે ઔશ્વરને, છોડીને હિંદુસ્તાનનું ભલું નથી ચાહતો,

કારણ મને વિશવાસ [ખાતરી] છે કે જે માણસ ઔશ્વરને ભૂલી શકે છે
તે દેશને [પણ] ભૂલી શકે છે.

આપણી પડતીની સથિતિનાં કારણો તપાસતાં જણાશે કે

તેમાં સરકારના કરતાં આપણો હાથ વધારે છે.

આપણામાં સડો ઓછો ધોવાનો નથી.

તે બધી બાબતોનો નિકાલ કરતાં આવડે,

એનું જ નામ સ્વરાજ,
 સ્વરાજનો અરૂથ જ પ્રજાપુરુશારૂથ છે.
 છાતીમાં ગોળી ખાવી, એ એટનું કઠણ કામ નથી;
 પણ રોજેરોજ કામ કરવું, ફુશણે ફુશણે પોતાની સાથે લડાઓ કરવી,
 પોતાની આત્મશુદ્ધિ કરવી, એ કઠણ કામ છે.
 કેટલાક લોકો અધિકારની લગામ મેળવી લે તેથી નહીં,
 પણ અધિકારની સામે થવાની શક્તિ બધા લોકોએ મેળવ્યાથી જ
 ખરું સ્વરાજ મળવાનું છે.
 જીવનની એકેએક બાબતના નિયમન માટે
 લોકો સરકાર તરફ જ તાકતા રહે,
 તો એવી સરકાર દુખરૂપ જ બનશે.
 સ્વરાજનો અરૂથ છે
 સરકારના અંકુશમાંથી સ્વતંત્ર થવાનો સતત પ્રયાસ.
 પછી એ સરકાર પરદેશી હોય કે રાષ્ટ્રરીય.

*

હિંસા

ચાહે તેટલા અુમદા ધ્યેયને અરૂથે વાપરવામાં આવેલાં
 દ્રવેશ અને હિંસા કેવળ દ્રવેશ અને હિંસા પેઢા કરે છે.
 આપણે વિદેશી રાજકરૂતાઓ સામે હિંસા વાપરીએ,
 તો તે પછીનું સ્વાભાવિક પગલું એ હશે કે
 આપણે જેમને દેશની પ્રગતિમાં બાધા નાખનારા ગણી શકીએ
 એવા આપણા પોતાના લોકો પ્રત્યે પણ આપણે હિંસા આચરશું.
 જેઓ સુધારા માટે તૈયાર નથી એવા લોકો,
 તેમના અુપર બળજબરી થતાં ગુસ્સાથી ગાંડા બનશે,
 અને વેર લેવા માટે વિદેશીઓની સહાય શોધશે.
 નિશ્શાસન્ત પ્રતિકારની પદ્ધતિ સૌથી વધુ સલામત છે,
 કેમ કે ધ્યેય સાચું ન હોય તો
 વેઠવાનું કેવળ એવો પ્રતિકાર કરનારાઓને જ હોય છે.

સુધારો

હિંદુસ્તાનની અત્યારે રંકડી દશા છે.

તે કહેતાં મારી આંખમાં પાણી આવે છે.

હિંદુસ્તાન આજકાલ [પશ્ચિમના] “સુધારા” નીચે કચરાયેલું છે,
તેની ઝડપ(ઝપટ)માં આવી ગયું છે.

શરીરનું સુખ કેમ મળે, એ જ સુધારો શોધે છે.

“સુધારા”ની ખૂબી એ છે કે

માણસો સારું માનીને તેમાં જંપલાવે છે.

“સુધારો” તો અંદરની જેમ ફૂંકીને ઝોલી ખાય છે.

જેમ જેમ હું અવલોકન કરું છું, તેમ તેમ

મને આધુનિક જીવન પરતે અસંતોશ વધતો જાય છે.

ચામડી અભેડતા, બાળતા, નાકકાન કાપતા,

એ જંગલીપણું હતું.

પણ આધુનિક જુલમ તો મોહજાળ છે,

તેથી તે વધારે ખરાબી કરે છે.

એક માણસના સ્વતંત્ર જુલમને પહોંચી શકાય.

પણ લોકોને નામે લોકો અધ્યર જુલમ થાય,

તેને પહોંચી વળવું બહુ મુશ્કેલ છે.

લોકોની પાસે કુંઅની પણ કામ કરાવવું હોય

તો ધીરજ રાખવી જોઅઓએ;

સુધારાની ગરજ રહી સુધારકને પોતાને;

જે સમાજમાં તે સુધારો બિચ્છે છે ત્યાંથી તો

તેણે વિરોધની ને જાનના જોખમની પણ આશા રાખવી રહી.

સુધારક જેને સુધારો માને,

તેને સમાજ કુધારો કાં ન માને ?

જેમ દિવસ જાય છે, તેમ પરજ ઘડાય છે.

પરજ કુંઅની એક દહાડામાં થતી નથી.

*

શરદ્વધાનું પ્રતિબિંબ

મનુશયાચાણીએ કેટલોયે અન્યાય કર્યો હોય અને કેટલાંયે પાપ કર્યાં હોય,
તોપણ મનુશ્ય એ મનુશ્ય છે; તેને આખરે ધર્મમનો રસ્તો સૂક્ષ્મો જ,
એવી ગાંધીજીની અમર શરદ્વધા છે.

એ શરદ્વધાથી જ તેઓ બધું સહન કરે છે,

અને સહન કરીને પોતાની શરદ્વધા બીજામાં રેડે છે.

તેમનું બાળક જેવું નિરૂપણ મુક્ષત હાર્ય એમની એ શરદ્વધાનું જ પ્રતિબિંબ છે.

લોકવાસ્તવામાં જે વર્ણન આવે છે કે

પવિત્ર પુરુષોના હાર્ય સાથે પુશપ અને મોતીના પોશ જરે છે,
તે ગાંધીજીના હાર્યમાં ચરિતાર્થ થયું છે.

કેટલાક પાસે વિશ્વવિજ્ઞી તલવાર હોય છે,

કેટલાક પાસે વિશ્વમોહિની ચતુરગભી હોય છે,

કેટલાક પાસે વિશ્વવર્ણી રૂપ હોય છે,

કેટલાક પાસે વિશ્વભયંકરી સત્તા હોય છે.

ગાંધીજી પાસે આમાંનું એકે નથી.

તેમની પાસે ફક્ત વિશ્વપ્રેમી હાર્ય છે—

અને તે એક હાર્યની અંદર બધી શકૃતિઓ સમાયેલી છે.

આ પવિત્ર હાર્યે ચોર-લૂટા અને ખૂની લોકોને
સમાજના હિતેચું બનાવ્યા છે, ધૂરૂતોને લજ્જિત કર્યા છે,
પારકાને પોતીકાં બનાવ્યા છે, બગડેલાંઓને સુધાર્યાં છે,
કટૂર વિરોધીઓને હિલોજન દોસ્ત બનાવ્યા છે.

કાકા કાલેલકર

*